

PARSI TIMES

Volume 11 - Issue 34 • Saturday, 04 December, 2021 - Friday, 10 December, 2021 • English Gujarati Weekly • Mumbai • Pages 16 • Price ₹8/-

THE TRUTH. DELIVERED WEEKLY.



Fresh
to home



WIN 6 GOLD COINS

EVERY DAY*

CASHBACK & OTHER EXCITING OFFERS



Chicken

(Curry Cut)

₹99/500g



2000+
Products



22 Lakh
Customers



100+
Quality Checks



No Antibiotic
Residue



No Added Chemicals

Order online at: [Freshtohome.com](https://www.freshtohome.com)



90 Minute*
Delivery



*not available in Nashik.

*T&C Apply. All prices are inclusive of taxes. Offers valid only for today and till stocks last. Images used are for representative purposes only and may differ from the actual products. This is only a brand name or trade mark and does not represent its true nature.

NCPA Presents Christmas With
MERLIN And The ALL STARS

NCPA presents an exciting X'mas treat with artists of all ages, genres and styles congregate to bring you Christmas... including 7-year-old stars Ivana and Tiana who have rewritten their own lyrics too, and Elvis as well as a play by a senior citizen and more surprises! Spreading cheer and messages of Faith, Hope, Love and Joy, some of these award-winning artists have sung for Disney Netflix and films, NCPA brings you Operatic Arias, Rock n roll, Indo-Fusion, Rap, Swing, Pop, Reggae and Jazz, Carols, et al to enthrall your senses. And don't miss the befitting finale - an original by Merlin and Asif - 'IT'S CHRISTMAS' - where the audience and artists sing together! The ensemble includes Merlin Dsouza (Piano);



Saurabh Suman (Bass Guitar); Adil Manuel (Lead Guitar); Linford Dsouza (Drums); and The Ramakrishnan Sisters (Violin Cello Keys), and lots of other artists!

Advertisorial

FROM THE EDITOR'S DESK

Come December.... The Beginning Of The End!



Dear Readers,

The popular saying, 'Every end marks a new beginning', is usually meant in a consolatory or comforting context - but thanks to the harrowing pandemic, time can't be ticking fast enough to conclude this deadly chapter that has shaken the core of humanity. We can't wait to belong to a future time, when we can look back and know that we are well and truly done with Covid and its various mutations. Which is why we more than welcome December, the last month of this year, which marks beginning of the end of 2021.

But the pandemic is not the only malady we hope and pray for, to end. There are a few other equally harmful ailments that the community has been riddled with and we sincerely wish that December would equally mark 'the beginning of the end' of all these as well, alongside 2021. The first thing that comes to mind is our declining population - may December turn the tables on this uphill, or as some would say, losing battle and may 2022 usher in the births of lots of healthy and happy Parsi babies, to ensure the longevity of our glorious community.

May December also mark the beginning of the end of everything negative that we live with - pain, grudges, anger, spite, hatred, regret... et al. May we enter the New Year with renewed spirits, repaired hearts, healthy bodies and restored faith to take on life's challenges and live the truly Zoroastrian way of life, embracing truthfulness, industriousness, kindness, happiness and generosity.

And last, but by no stretch of the imagination, the least, may the last month of this year ensure that we have heard the last of all the instability and acrimony within our most august institution - the BPP. May December herald the beginning of the end of all disharmony within the Trustees as also any malicious agendas compromising the welfare of the community; may our elected leaders work in the best interests of the community members and lead us into 2022, as the enablers of justice and rectitude.

There are far better things that lie ahead of us than any that we have left behind - now if only December would do its bit!

Have a good weekend!

- Anahita

anahita@parsi-times.com

THE FIRST DASTOOR MEHERJIRANA LIBRARY

Tarota Bazar, NAVSARI-396 445

PHONE - (02637) 245847

meherjirana_lib@yahoo.com

Website: <http://www.meherjiranalibrary.com/>

Registered Charity Trust
Regd. No. E/915 (Mumbai)

Registered Office of the Trust
M.52 Cusrow Baug, Causeway,
Mumbai 400039.
(M) +91 98706 53716

BOARD OF TRUSTEES

Miss. Katy K. Antia
Mr. Jimmy M. Tata
Mrs. Zenobia T. Pestonjamas
Mrs. Vera F. Choksey

Date: 30/11/2021

To Adopt A Book

First Dastoor Meherjirana Library in Navsari founded in 1874 is a treasure trove of centuries old manuscripts & books on history & culture of Zoroastrian religion. Some of these manuscripts & books are in bad condition / shape thereby requiring restoration, preservation & conservation for our future generations to refer. This project & process requires funds **to the tune of 30 lakhs & above**. Any Monetary - financial support (donation) from an individual or institution is welcome. A donor of Rs.5001.00 & above can adopt a book in his or her name or in the loving memory of their loved ones. Accordingly upon restoration the name of the donor or and or his loved ones will be recorded in the inner title or preface page of the book. Funds are also required to maintain the old building as well as to construct a new administrative block which is declared necessary by the Structural Auditor. Cheques may please be drawn in the name of The First Dastoor Meherjirana Library with a covering letter mentioning for which purpose the donation is given. Cheques may be sent to First Dastoor Meherjirana Library, Tarota Bazar, Navsari - 396445. Gujarat. Donation can also be made through net banking (on line) by NEFT / RTGS to our saving bank account with State Bank of India, Post bag no. 18, Near Fuvara , Navsari, 396445, **A/c. No. 10272024867, IFSC : SBIN0000439.**

or State Bank of India, Mumbai Main Branch, Mumbai Samachar Marg, Horniman Circle, Fort Mumbai 400001. **Current account A/c. No. 10996688601. IFSC : SBIN0000300.** Every donation received is eligible for Income Tax exemption under section 80G of Indian Income Tax Act and the same will be acknowledged with a receipt sent to the donor hence a covering letter is essential.

We appeal to you for your generosity to this institution which is widely known around the world.

Thank you and warm regards,

Yours sincerely,

Miss Katy K. Antia

Chairperson / Trustee

Religious Announcements

Nirangdin Ceremony At Wadiaji Atashbehram

A Nirangdin ceremony will be held at midnight at Wadiaji Atashbehram, on 10th December 2021, (Roj Asman, Mah Tir, YZ 1391), in remembrance of Veera Faramroz Variava, by her son and daughter-in-law - Dinshaw and Khurshid Variava. All Zoroastrians are welcome to attend.

વાડયાજી આતશ બહેરામમાં નીરંગદીનની ક્રિયા

શુક્રવાર તા. ૧૦-૧૨-૨૦૨૧ રોજ - આસ્માન માહ તીર ૧૩૯૧ની મધ રાત્રે નીરંગદીનની ક્રિયા મરહુમ વીરા ફરામરોઝ વરીયાવાની નેયતે એમણા દીકરા, વહુ દીનશાહ ને ખુરશીદ વરીયાવા તરફથી કરવામાં આવશે. સર્વે હમદીનોને પધારવા આમંત્રણ છે.

SUBSCRIBE TO

PARSI TIMES

THE No. 1 PARSI PUBLICATION!

ANNUAL SUBSCRIPTION

India and Upcountry

Rs. 750/-

PLUS 5%
GST

E-paper sent to you via e-mail Rs. 1,500/-

Kindly write your Cheques in favour of: Parsi Times Multimedia Pvt. Ltd

Address: Framjee Cawasjee Institute
Annexe Building, 3rd Floor, Opp Metro Cinema,
Dhobi Talao, Mumbai - 400 002

Tel. No.: (022) 22010704 /05

To receive the newspaper (hard copy) in countries out of India,
kindly e-mail us at: editor@parsi-times.com

Our Sister Concern





IA for Maharajas' Express



**HOLIDAY LIKE A MAHARAJA WITH MODESTY ON
WORLD'S MOST LUXURIOUS TRAIN**

Delhi - Agra - Ranthambore - Jaipur - Delhi




Published Price
2,93,450 per person
Deluxe Cabin

Tibro Exclusive Deals
1,75,000 per person
Deluxe Cabin

DEPARTURE DATES


CHRISTMAS EVE - 23RD DEC
NEW YEAR EVE - 29TH DEC*
POST NEW YEAR - 20TH JAN 2022

FOR PRICES AND DETAILS CONTACT

Chintan Chheda
info@tibro.in
+91 93224 64312
www.tibro.in

CONDOLENCE MEETING

In Memoriam



Yazdi Hosi Desai
(7th October, 1959 - 2nd November, 2021)

During his lifetime, Yazdi touched the hearts and minds of innumerable community members and served the community and society at large, with dedication and valour, for over 20 years.

WAPIZ will convene a Condolence meeting to Honour the Life and Times of former Chairman of WAPIZ and BPP, Yazdi Hosi Desai:

Date : Saturday, December 4, 2021 (Mah Tir - Roj Ram)
Time : 6:00 PM
Place : Rustom Baug Pavilion

All are welcome.

WAPIZ TRUSTEES

"Very often a change of self is needed more than a change of scene."

- Arthur Christopher Benson



We invite you to
inner vision
Exhibition and Sale

Pottery • Ceramics • Woodwork
Mosaics • Handloom Items • Cards
Gifts & more...

at
HAPPY HOME AND SCHOOL FOR THE BLIND

Dr. Annie Besant Road, Worli, Mumbai 400 018
Friday 10 December to Sunday 12 December 2021
10.00 a.m. to 6.00 p.m.

HSBC 




- 155 years in business
- Presence in 50+ countries
- 50,000+ global workforce



Shapoorji Pallonji
Built to last...since 1865

Shapoorji Pallonji And Company Pvt. Ltd.
Corporate Office: SP Centre, 41/44 Minoo Desai Marg, Colaba, Mumbai - 400 005
Tel: +91 22 6749 0000 Website: www.shapoorjipallonji.com

The Essence Of A Zoroastrian Marriage



NOSHIR H. DADRAWALA

The festive season heralds the onset of marriages. From a Zoroastrian viewpoint, marriage is the celebration of life itself. To understand our prayers, most of us need to refer to translations. A marriage is hopefully, a once-in-a-lifetime experience and many, especially those getting married, would like to understand its essence from a religious perspective. Noshir H. Dadrawala brilliantly elucidates the beauty and the wisdom behind the prayers said during our Zoroastrian marriages.

The scriptures not only encourage, but also enjoin marriage, including so for the clergy.

Vendidad (4.47) states:
"O Spitama Zarathushtra!
Indeed, I thus recommend
hereunto thee
A man with a wife above a
Magava (Holy man),
A man with a family above
one without a family,
A man with children
above one who is without
children"

Vendidad (3.1) also avers:
"That place is happy, over
which
A man builds a house
With fire, cattle, dogs,
wife, children
And good followers"

In the Holy Gatha (Yasna 53.5)
Asho Zarathushtra advises:
"I say these words to
you marrying brides and
grooms!
Impress them in your mind.
May you two enjoy
a righteous life by
following the law of Asha
(Righteousness)!
Let each one of you
clothe the other with
righteousness.
Then assuredly there will
be a happy life for you."



Clearly, the Prophet assures marrying couples that happiness will fill their lives if together they follow the right path. What is most uplifting is the thought regarding clothing each other with righteousness.

The marriage ceremony, which we in India commonly refer to as 'Ashirwad' commences with: *Avar dad va ain-i-Din-i-Mazdayasni* (According to the rules and customs of the Mazdayasni religion) and continues on to bless the couple thus:

"By the helping name of
Ahura Mazda
May your happiness
increase!
May you be brilliant!
Do good deeds!
Increase righteousness!"

Invoking the Bounteous Immortals (Amesha Spenta)

are showered thus:

"May Ahura Mazda bestow upon you:
Good thoughts and wisdom through Bahman
Truth and good health through Ardibehesht
Power and strength through Shehrivar
Piety and humility through Aspandarmad
Sweetness and perfection through Khordad
Fruitfulness and immortality through Amardad!

The officiating Priest continues then to invoke the various Yazata and blesses the couple with luster through Adar, purity through Avan, exalted position through Khurshed, justice through Meher, wealth through Ashishwangh and eternal light and nourishment

through Aneran!

The Priest then blesses the groom with qualities that the Great Kings and paladins of ancient Iran were known for:

"May you be:
Great in dignity like Kai Khushrow
Victorious like Zarir
Pious as Vistasp
Strong as Sam
Powerful as Rustom!"

The Ashirwad ceremony concludes with various admonitions including:

"Do nothing without mature consideration.
Acquire wealth by righteous means.
Be industrious.
Fight your opponents only by fair means.

Speak with great consideration when in an assembly"

And, just before concluding, the priest chants:
"Be more glorious than your father.
In no way annoy your mother.
Recognize Ahura Mazda as your God.
Remember Zarathushtra as your spiritual guide.
Treat Ahriman (evil) with contempt!"

Thus, for a Zoroastrian, marriage is a path to happiness through righteousness. It is not a contract. It is about good companionship. It's about friendship. And, above all else, it is about making this world a happier place to live in!



Avail 'Naju And Keki Billimoria Scholarship' For College Education

Last Date To Apply: 31 December, 2021

The Naju and Keki Billimoria Scholarship, has been established by USA-resident Farrokh Billimoria for the benefit of underprivileged Parsi youth of India, who wish to pursue a college education. This endowment will award up to 4 years in scholarships to Indian students who have no means of paying for their education. Students applying to Engineering, Medical, Law or Pharmacy colleges are eligible for the scholarship.

Eligibility Criteria: (i) Students would need to be admitted to a college in India to be considered; and (ii) Family's annual income should be Rs. 2.5 lakhs or less.

Application Procedure: Candidates should apply online at the FFE Site: www.ffe.org and follow-up with an email to: scholarships@ffe.org, along with their Name in full and contact information (Email, Address and Tel. no). You could also follow up with a call

on: (+91) 88615 01155 / 080 2520 1925.

PLS NOTE: Last Date To Apply is December 31, 2021.

Candidates graduating from orphanages are especially encouraged to consider applying for this opportunity. All community members are requested to share and publicize this opportunity as much as possible, as this could make a huge difference in the lives of Parsi youth who have the talent and the intelligence to achieve academic greatness, but are

held back due to financial constraints.

This scholarship is managed by Foundation for Excellence (FFE), which has awarded over 70,000 scholarships over the last two decades and has a proven process for screening and selecting candidates. Farrokh Billimoria - Managing Partner and Co-Founder at Green Leaf Capital, has set up this generous endowment in perpetuity, in honour of his parents - Naju and Keki Billimoria.

P.T. CLASSIFIEDS

ACCOMODATION AVAILABLE

WELL Doneup, Ownership 650 Carpet Area, Top Floor, Converted 2 BHK in AH Wadia Baug. Also in Patel Agiary Building, Andheri. Agent: 9821565546.

AIR CONDITIONERS / REFRIGERATORS

We buy Old /Second hand Air Conditioners, Refrigerators, Deep Freezers for Cakes, Bengali Sweets. Old Water Pumps, Electrical Items & Cars. Contact Mushtaq 7021851891.

ANTIQUES

DHIRAJ
Old Antique Shop
VALUE GIVEN IS
MORE THAN MARKET RATE
We also collect Goods & give free Home Service
Old Furniture, Watches, Old Fountain Pens, Kerba, Old Crockery, Old Resham Kore And Zari, Old Toys, Old Camera, Old Notes And Coins, German Silver.
CONTACT: DHIRAJ
9819774578 / 8369666193
99, Sai Shop, Next to Cumballa Hill Hospital, Kemps Corner, Mumbai-36

BUYING OF ALL TYPES OF ANTIQUES & FURNITURE
E.g. Coins, Notes, Watches, Wall Clock etc. Maharashtra & Gujarat.
Buying/Selling Of Second Hand Cars
Contact. Mr. Irani
8169835441
WhatsApp: 9322871171

AARAV
OLD ANTIQUE ITEMS
VALUE GIVEN IS
MORE THAN MARKET RATE
We also collect Goods & give free Home Service
Gold & Silver Jewellery, Watches, Old Furniture, Gramophones, All Records, All Cameras, Old Fountain Pens, Gara, Kerba, Old Crockery, Zari Border, Old Notes, Coins, German Silver, Household Items
CONTACT: AARAV
9324503876 / 8169751275
181, Shop No. 13, Bora Bazar, Fort, Mumbai-1

SHOP FOR RENT
155 carpet commercial space in Dadar Parsi Colony
Cosmopolitan Building
24 hrs water access, attached toilet
Suitable for Salons, Doctor's Clinic & Offices
Contact - Ruhanghiz
9136299216
9867995356

CAR HIRE
PARSI Owned & driven AC car available on Hire for Airport transfers & Outsations Trip to Udvada, Navsari, Surat.
Please Contact
HOCO TRAVELS
Mr. Pirran on
9920829269 / 9326483379

CATERERS
Delicious Parsi Cuisine
Tiffins / Party Orders / Snacks etc
Monday to Saturday Lunch and Dinner
(4-5 Dishes with Rice)
If interested please call
Nargis Irani
7400038249

CLOCK AND WATCHES
WE BUY Used Watches

Rolex, Omega, Cartier, Tudor, AP, Hublot, Patek Philippe, etc.
Call: Atul 9820147144

DRESS MAKER/TAILOR
SADRA LENGHA
ALL SIZE READYMADE SADRA AVAILABLE.
YOU WILL ALSO GET SADRA STITCHED BUY ORDER TOO.
WE TAKE BACK SHRINKED SADRAS.
TATA MALMAL 704 USED.
FREE HOME DELIVERY.
MR. PITHAWALA
9920269433

THANA - KALYAN LONAVALA
Sunday~1 Day~Religious Tour
By Airconditioned Coach
Morning Breakfast with Tea, Lunch and Evening Tea.
Dep. On DEC 12, 2021
Marespand Roj **Rs. 2599**
DINI TRAVELS
9892242994
9137068875

COURIER
PAC n DELIVER
INTERNATIONAL COURIER
Send parcels to your Children & loved ones in CANADA, UK, USA & WORLD WIDE including Garments, Farsan, Chocolates, Sweets, Gifts, Eatables, Medicines & any permissible item & get benefited with SPECIAL rates.
Contact - Mr. ANUJ SANGOI
Tel. - 022-48932230 / 8879991866
Email - sales@pacndeliver.com
"20 Yrs of Quality Service"

FOR SALE
NEW BUNGALOW, FLAT, OLD FLAT & NA PLOT AVAILABLE
Nargol, Saronda, Tadagam, Maneckpur, Daviyar, Etc, Sanjan Station, Gujarat
Contact
09825808958

PACKERS & MOVERS
DATTA Tempo Service for hire, shifting with skilled labourers. We regularly service - Mumbai to Pune, Nashik, Deolali, Sanjan, Nargol, Udvada, Navsari. 9821319228

MUSIC CENTRE
BEST PRICE
We deal in all types of EMI Old Hindi CDs & English Blu ray Disc, Vinyl Records Hindi & English, Turntable, Hi End Music System, Old CD Games, G.I. Joe, HE Man Toy, Vintage Telephone, Rupee NOTE BUNDLES (1,2,5) & Coins, Zari Border & Sarees, LCD TV, Laptop & All Electrical Items.
We Collect all Material from your Doorstep!
Contact:
9920663443 / 7738935999.

Online Meat Delivery Player Freshtohome On Offline Expansion Spree



Online meat delivery platform FreshToHome is on a rapid expansion overdrive with plans to add 70 outlets by the end of this year to take its offline store count above 100 across India. Having entered the offline journey nine months back, FreshToHome plans to aggressively tap the traditional channel.

"We have seen a pattern that in areas where our offline stores are operational, the growth in online sales has



Shan Kadavil, Co-founder and CEO, FreshToHome

jumped by six-seven times. We see offline as a big enabler for our online revenue," said Shan Kadavil, Co-founder and CEO, FreshToHome, which is currently present in 56 towns and cities. The company is homing in on metros like Bengaluru, Chennai, Mumbai and Delhi. It also plans to launch three stores in the UAE as it draws 10% of its revenue from international operations. The average size of the new stores will be 300-400 square feet, while the company also plans a few large-format, 1,500-square-foot outlets.

In step with its plans for a wider footprint, the company has lined up a host of new products. "We plan to launch by December clean label 'ready-to-cook products' which have no preservatives and chemicals. The range has been introduced

in Dubai," said Kadavil. It will launch 15-20 stock keeping units under this category. The ready-to-eat and ready-to-cook segments of the product line contribute about 5% to its sales. The company plans to jack it up to 15-20%. According to Kadavil, ready-to-cook and ready-to-eat meat form a \$1-billion segment. "It has high return on investment and younger consumers particularly are going for this category."

The company has tied up with modern trade stores like EasyDay and More Hypermarket to roll out its ready-to-cook and ready-to-eat products. FreshToHome is present in about 50 outlets and plans to launch these products in 100-200 stores. A report by RedSeer Analytics in March pegged that the meat market is expected to reach \$80-85 billion by 2024 and is up for disruption by branded players, while online meat delivery grew 2.5-3 times during January-September 2020.

Launched in 2015, FreshToHome sources meat and fish directly from livestock farmers and fishermen and then supplies fresh produce at mass-market prices in the UAE and all major Indian markets, including Delhi/NCR, Bangalore, Mumbai, Pune, Kerala and Tamil Nadu. The company which competes with players like Licious, Zappfresh and TenderCuts, claims it has an annual revenue of Rs 1,000 crore and processes about 1.5 million orders a month. It has raised \$154 million in funding till date as to last year when it had raised \$121 million in Series C round funding.

Advertisorial



Parsee Gymkhana Clinches Madhav Mantri Tournament!



BINAISHA M. SURTI

Parsee Gymkhana (PG), the most popular and loved team in Mumbai Cricket, has garnered a massive fan following beyond the city and India... including Austria, England, UAE, Australia, New Zealand and even Russia! PG's cricketing chronicles continue to win hearts that beat for cricket the world over! This unit is very special indeed as it continues to produce, nurture and groom talent, year after year, through pure cricketing skills. The PG flag continues flying high, doing the community proud, as they continue their winning spree - this time winning the prestigious Madhav Mantri Centenary One Day League 2021-2022. Parsi Times Reporter Binaisha M. Surti brings you all the action of the grand finale which took place at the Mumbai Cricket Association's Bandra-Kurla Complex ground.

Parsee Gymkhana has repeatedly proven it is a powerhouse in the cricketing arena, clinching yet another title on 24th November 2021 - a massive win by 166 runs overpowering opponents Karnatak Sporting Association in the final of the MCA organized Madhav Mantri Centenary One Day League Tournament at the Mumbai Cricket Association's BKC ground. This comes on the heels of winning the Padmakar Talim Shield T20 Cricket Tournament, last month.

Late Madhav Mantri was a former Indian cricketer who later played for Bombay - a great opening batsman and wicketkeeper. In his excellent first-class career spanning 25 years, he amassed 2,787 runs. One of the most respected and valued cricketers, his top score was 200 for the then Bombay team V/s Maharashtra, in 1948-49. Born in 1921, this year marks his centenary birth year, hence the occasion was celebrated with this tournament.



From Lto R - Parsee Gym's Pervez Hodiwalla, Khodadad Yazdegardi and Mayoer Bhatia

Former India cricketer, Vinod Kambli graced the occasion for the toss of the day-night final contest. Put into bat first, PG notched up a competitive total of 303-8 in 45 overs. Opener Aakarshit Gomel and number three batsman - Sachin Yadav contributed 36 runs each. Aakarshit hit four superb boundaries, while Sachin pierced the gaps for five boundaries. At 133-5 in 22.5 overs, senior pro, Aditya Tare took over to score a massive 112 runs partnership for the 6th wicket with Parag Khanapurkar (42 runs). Aditya played a well-crafted innings of 99 runs, which included 15 fours and 1 maximum. Tushar Deshpande walked in next, smashing an outstanding unbeaten 37 off 18 deliveries, including four boundaries and two maximums. For Karnatak Sporting Association (KSA), Ankeet Chavan, Tanush Kotian and Aishwary Surve picked two wickets each.

In reply, when KSA came into chase down the total, the game came to a halt



Parsee Gymkhana- Winners of Madhav Mantri Tournament

due to floodlight failure when they were 20-0 in 5 overs at 5:24 pm. The match resumed at 8:15 pm, turning into a one-sided affair as wickets fell at regular intervals. Ankeet Chavan perished on 45, after Shams Mulani hit bulls' eye with a direct throw at the stumps. The PG bowlers stuck to their line and length, not giving away easy runs. Finally, the Karnatak team made just 137 in 30.2 overs. Shams was the pick of the bowlers with his outstanding (4-23) in 5.2 overs while Tushar Deshpande and Skipper Vikrant Auti snapped up 2 wickets each.

Chief Guest - ex-captain and illustrious former India cricketer, popularly known as 'Lord of Lord's' - Dilip Vengsarkar, graced the prize distribution ceremony, congratulating PG and Khodadad Yazdegardi for the outstanding victory and applauded both teams for great sportsmanship spirit.

Speaking exclusively to Parsi Times, post another massive championship win, an elated and proud Parsee Gymkhana President - Mehli Golvala shared, "It's good that sports is playing a key role in helping the world extricate itself from the pandemic. The standard of club cricket in Mumbai is highly competitive. Winning one tournament in a season is always a satisfying and great feeling. In the present season, a 20-over tournament, followed by the 45 over one, just shows the depth and versatility which is highly creditable and moreover, in the absence of our player Surya Kumar Yadav who was away on national duty for India."

PG' Cricket Sub-committee member Pervez Hodiwalla shared, "Our PG team has had tremendous success winning two titles. The performance of this particular side has been exemplary and we have great potential to carry on

reaching greater heights in the Mumbai cricketing circuit. Hats off and a job well done by Khodadad." Added Mayoer Bhatia, Honorary Treasurer and Cricket Sub-committee member, "Back-to-back wins for our team in the Talim Shield and Late Madhav Mantri final is the fruit of building a cohesive unit with proper process and work ethics over a period of time and lots of hard work by the coach, players and the team management."

Captain of PG - Vikrant Auti said, "This is our second championship this season and it feels very special and gratifying to lead such a superb team. The boys showed great character after losing the first game and then coming back strongly to win the tournament. We played as a unit - we are like a family at PG and that crucially contributes to our success. I thank Khodu Sir (Khodadad) and coach Vinayak Mane for their constant efforts and creating that family atmosphere within our team. I hope we continue the winning momentum in future as well."

Senior pro and PG's outstanding wicketkeeper-batsman, Aditya Tare said, "PG has shown its dominance in club cricket once again. We have a balanced team and lots of match winners in the squad. We again dominated through the entire tournament and were the deserved champions in the end." All-rounder and current Mumbai captain for the Vijay Hazare tournament, Shams Mulani said, "During every game, there were players who performed when it mattered, taking the game away from the opposition. This tournament was all about character and great intent. We did that during the final too, winning it comfortably."

Despite his absence as he's playing for Team India, PG's Surya Kumar Yadav said, "Congratulations to the entire PG family. Winning two tournaments in succession speaks loads about our game. The team showed great character. The hard work has paid off. It's been complete team effort! Focus on the process and results will automatically be taken care of!" PG coach, Vinayak Mane said, "Back-to-back titles is very special for PG. Everyone contributed - the whole squad looks united and are happy for each other's success. Vikrant Auti captained the side well. We worked through all tough situations - every player put in top effort."

Khodadad Yazdegardi, Vice President and Cricket Secretary of Parsee Gymkhana; as also MCA Apex Council Member and Team PG's biggest support system, concluded with, "To win another back-to-back title is great, especially the inaugural Madhav Mantri Tournament. The team's sheer dominance was heartwarming to see. Every player is standing up and performing when needed. The most beautiful part about this victory is captain Vikrant saying how none of our team boys won any individual award but collectively dominated all through and won by huge margins! That shows our team is well knitted! The coach and support staff is doing a brilliant job, players are executing their roles to perfection. A big thank you to PG President Mehli Golvala who has been very supportive; Co-sponsors - Spenta and NJ wealth for providing us with team clothing and also my Managing Committee and Cricketing Sub-Committee for all their support. I hope and pray we go on to win many more championships this year and make it an even more memorable year!"

Iran's Minister Promises Relief To Kurdistan Zoroastrians



On 26th November, 2021, Iran's Minister of Immigration and Displacement - Evan Fayek Jabo, visited the Zoroastrian (Ateshga) and the Yesna Zoroastrian organization in the city of Sulaymaniyah, Kurdistan, to closely inspect the conditions of Zoroastrians living there. She was received by a number of Zoroastrians, led by Awat Husam Al-Din, the Zoroastrian representative in the Ministry of Awqaf and Religious Affairs in the Kurdistan Region, alongside Asrawan Qadiruk - Supervisor of the Zoroastrian temple in Sulaymaniyah; Azad Saeed - Supervising

Director of the Yesna Organization, and a number of members of the Zoroastrian High Commission.

Zoroastrians from Kirkuk and Tuz Khurmatu have been affected by the security conditions that Iraq experienced in the exceptional circumstances that occurred due to ISIS and its aftermath. Minister Evan Fayek Jabo gave a patient listening to their needs and has promised to resolve the issues as well as compensate them for the damages they suffered.

Udvada Station To Be Developed On 'Climate Action, Eco-Restoration' Theme By Viral Desai



Surat-based Entrepreneur, popularly known as the Greenman, Viral Desai, has undertaken the mission to transform and redevelop Udvada Railway station on the theme of climate action and ecosystem restoration. He has completed the first phase of work through his NGO, 'Hearts at Work Foundation' by planting more than two and a half thousand trees, alongside the construction of long parapet walls measuring over five hundred meters,



for plantation. His environmental venture was inaugurated by Western Railways GM - Alok Kansal and Vada Dasturji of Udvada, Khurshed Dastoor.

A 'Hut of Gratitude' thanking the Parsis for their contribution towards India's progress and upliftment has also been installed. Titled 'Proud Pillars of Parsi Community', the biographies of Parsi frontrunners and trailblazers, including greats like Dr. Homi Bhabha,

Iran's Ancient Sassanid Fire Temple Demarcated For Protection



The Khorramdasht Fire Temple, an ancient Sassanid-era monument, located in central Iran, has been demarcated to be protected from any possible destruction. A team of Tehran's archaeological and cultural heritage experts has defined boundaries for this historic fire temple, which is an example of the Chahar-taqi buildings - an architectural unit consisting of four mudbrick barrel vaults and a dome.

The Sassanid era (224 CE-651) occupies great importance in Iranian history. Under the Sassanids, Persian art and architecture experienced a general renaissance. Architecture often took grandiose proportions such as palaces at Ctesiphon, Firuzabad and Sarvestan which comprise the highlights of the ensemble. According to UNESCO, the architecture of Sassanid monuments in the property further illustrates early examples of construction of domes with squinches on square spaces, such as in the Chahar-taqi buildings, where the four sides of the square room show arched openings: this architectural form turned into the most typical form of Sassanid

religious architecture, relating closely to the expansion and stabilization of Zoroastrianism under Sassanid reign and continuing during the Islamic era, due to its usage in religious and holy buildings such as mosques and tombs.

The Sassanid archaeological landscape also represents a highly efficient system of land use and strategic utilization of natural topography in the creation of the earliest cultural centers of the Sassanid civilization. Crafts such as metalwork and gem-engraving grew highly sophisticated, yet scholarship was encouraged by the state. In those years, works from both the East and West were translated into Pahlavi, the language of the Sassanians.

In 2018, UNESCO added an ensemble of Sassanian historical cities in southern Iran, titled, 'Sassanid Archaeological Landscape of Fars Region' to its World Heritage list. The ensemble comprises eight archaeological sites situated in three geographical parts of Firuzabad, Bishapur and Sarvestan.

Jamsetji Tata and Dadabhai Naoroji, have been chronicled in this section.

The Udvada railway station master's office has also been designed on the 'Alright Green Zone', with the exteriors focusing on climate action and ecosystem restoration. Udvada has become the first railway station in the country to give a green signal to climate action and eco-restoration, from the country's first Green Alright Zone of the railways.

Speaking with the media on this occasion, Viral Desai said, "Udvada station will become a model station in the future and be acknowledged internationally as the first station based on the theme of climate action and ecosystem restoration. It will host over ten thousand trees and plants and become the first station of Indian

railways to host a Miyawaki forest comprising more than six thousand trees and a museum in honour of Field Marshal Sam Manekshaw. Ecosystem restoration work will be carried out at the station by combining the Indian Army, the environment and the Parsis, which will fulfil Prime Minister Modi's plans for climate action." The United Nations Environment forum will also be informed about these projects, where the model of Udvada station will be presented.

Impressed by the work of the first phase of Udvada station as well as his green vision for the future, Viral Desai was felicitated by the GM of Western Railways with a certificate of commendation and a medal by the Indian railways, in the presence of top officials.

Kayan Daboo Ordained Navar

Kayan Khushroo Daboo, son of Dilkhush and Er. Khushroo S. Daboo was ordained Navar at The Rustom Faramna Agiary, Dadar on 29th November, 2021 (Meher Roj, Tir Mahino). The Navar ceremony was performed under the guidance of Er. Kaizad Karkaria with Er. Kersi Karanjia and Er. Jehaan Darbari.

Er. Kayaan Daboo is the great grandson of Late Er. Ratanshaw C. Panthaki, who headed Rustom Framna Agiary for sixty years.



Malcolm Dastur Ordained Navar

Malcolm Dastur, son of Nazneen and Bomi Dastur, was ordained Navar on 26th November, 2021 (Tir Mahino Tir Roj), at Pak Iranshah Atashbehram in Udvada. The Navar ceremony was performed by Er. Dara Bharda and Er. Sarosh Bharda, with special thanks to Er. Zarir Dastoor, Er. Cyrus Darbari and Er. Kersi Bhada.



Rustom Patel Claims 4 Golds, 2 Silvers At All-India Dirt Time Attack Autocross

Mumbai's Rustom Baug resident, Rustom Kersi Patel, clinched an extraordinary haul of medals at the 'All-India Dirt Time Attack Autocross 2021', winning four Gold and two Silver medals, across six different categories. The event, which was held at Amanora Park in Pune, on 28th November, 2021, had over 121 riders who came down from all over India to participate.

The delighted and super-fit, 43-year-old Rustom Patel beat his fellow contestants - most being much younger than him, to win top place in the four categories: 'Four Stroke Upto 160 CC'; 'Four Stroke Upto 250 CC'; 'KTM Class Upto 400 CC'; and 'Veterans Open Class'. He notched the second spot in 'Mx Open Foreign Class'; and 'Time Attack Open Class'.

Speaking to Parsi Times, an elated Rustom shared his journey, "2007 was the year when I was declared National Champion of India in the 'MRF Supercross National Championship'. I remember accepting my trophy in Bangalore and taking the mic on the stage, with tears in my eyes, to declare that I was retiring from Professional Racing forever. Then, after 14 long years of being the Head Coach of Team Ajmera Racing India, I was only coaching but never raced.

But, last month I was invited to Assam



for a 3-day boot camp to coach the Assam riders. That's where it occurred to me, on my second day of training, that I still ride fast and still have almost the same speed in me, as well as the fitness and stamina. So I took 15 non-stop laps on the Assam track and just didn't want to stop at all! That ignited the spark in me to re-enter racing again.

I knew of the 'All-India Dirt Time Attack Autocross' event, which was to be held in Pune city in end-November, and I decided to give Racing a try again - just to see if I could at least figure in the Top-5 in this race because a 14-year gap is way too long, compared to the current National Champions who practice daily and are nearly half my age! So, I headed to Pune feeling a surge of positivity - mentally and physically - on my decision to race again."

And the rest, as they say, is history, as Rustom laid claim on six medals - four Gold and two Silver - shocking everyone, even himself as he didn't just beat the reigning champions who were half his age, he beath them by a huge distance and margins - 10 to 15 seconds! "I felt very proud to be the only Parsi on the racing track there and to have beaten so

many riders! More than ever, I believe age is truly just a number. It's your self-belief and your commitment which will raise you to the levels you wish to reach in life. I believe in hard work, dedication and honesty towards achieving your work - that is my mantra," adds Rustom, who is staunchly devoted to his physical fitness, running 10 kilometres daily to keep up his fitness levels, as racing is all about fitness.

Rustom Patel has a special message, especially for the youth of our community, which is known for its love for motorcycles and racing. "I want to emphasize this point to all our enthusiastic youngsters - please say 'NO' to street-racing. There are

so many people losing their lives and endangering the lives of others, due to these reckless street-racing stunts they try to pull off, trying to outdo their fellow street-racers. If you want to race, show your talent on the track, and not on the streets!" he stresses, adding, "If you really want to achieve something in life, then be honest, serious and apply full dedication to your goal and you will surely achieve it."

"I thank my sponsors - Castrol Viking, for their faith in me, as also my racing team - Venom - and my entire family for always supporting me through this journey. I also extend special thanks to Anahita aunty and late Yazdi uncle from WAPIZ (Anahita and late Yazdi Desai) for all their support through these years," says Rustom



Looks like there's no looking back or stopping him now, as Rustom has re-risen like the proverbial Phoenix - all prepared to take on new challenges and bring home more laurels! Here's wishing him the very best for his next racing pit-stop - the oncoming 'Valley Run 2021 Championship', which takes place on 5th December, 2021, at Ambi Valley.

PARSI TIMES *PT Timeout*

The Bawa Word Search

Search out the following 16 Bone Structures in our Body hidden in the word-jumble box below, in bi-directional, horizontal, vertical and diagonal forms:

F H A V U G H V M G M S H L O E Q L S J F L T A O
 U I R J Z D F A J H E Z K N E N I T A L U S L J B
 Z X W Z W G Z J Z L N R H T Z S I M S N N U L I M
 U R W I T G X E B Q T P A S R E P L J L B A S G X
 R X M C Q I L I Z B F A P A S C A U U I F Z I J F
 C S Z C G C D P I U I W L U H L A V F Z W M Q Y W
 A Q Q D M N P X E B F U I C J D N X B Z J Q J S K
 V A D I A B R J I G P D K K G R D F Q N F S J I F
 Y K D M X M F T X A A L M N G V O E U A C C H H Z
 O A I O D K W I C R A M U L G H Y M G J R D B A V
 O D Z V I Y I S Q I S X D F G B S U V V M M T M M
 U C E B Q M T S S Q C I I X K F H R C M C M M A B
 G H L A I B S X S I V Y S A J E B R S W Y U B F L
 I V C L V U X Q G H C Y L B N D F B G B H L T B D
 U J I L N X X T H W M L S I M W N D K I W B V M F
 R D V A J I H R A W E M P U X U C Q K U S D C N M
 H G A N F X O F J T V S C B R W I K G E Z C M W Z
 A F L D K L O D A E L O C W C E W N G L K A B Q M
 A N C S Z G O P R A L L R L B J M S A Y B Z H H C
 W V F O T W G F C I Q Q X U V Q P U D R A Q Z V K
 O N P C G R K I M M U N R E T S C T H L C A W L Q
 W G Y K N L V L X E A F N D Z W X Z K Y W O Q V Q
 D M R E C R E M P C C F F F H H F O M I L X I D C
 E I G T E S I V L E P A Y Q S P K R D Q P Q Y M P
 F U Q C I S H I N G E J O I N T L I J M V N C J C

- | | | | |
|-------------|-----------|----------------|-----------------|
| Cranium | Mandibles | Cervical Spine | Clavicle |
| Scapulars | Sternum | Radius | Patella |
| Talus | Femur | Fibula | Tibia |
| Hinge Joint | Pelvis | Humerus | Ball And Socket |




TechKnow With Tantra

Miro - Digital Whiteboards

Miro is a free tool for using digital whiteboards for Meetings, Workshops, Ideation, Brainstorming, Research & Design, Strategy & Planning and Mapping and Diagramming. It can be used on a desktop, tablet or your phone. The main App offers a variety of templates like Kanban boards, Flowcharts, Mind-maps, etc. Besides, it is multi-platform and works seamlessly for Windows, iOS, Android and Mac OS. You and team members can chat, message, comment, leave sticky notes, and create a centralized note for meeting elements. The premium version also includes video chat, voting, and screen sharing. With over 7 million users, it is a product you can use with trust and confidence.


Website: <https://miro.com/>

BAWAJI BHEJA FRY



HOW MANY WORDS?

How many words of four or more letters can you make from the letters below? Every word must contain the letter in the center. You should make at least one word using all 7 letters.



RESULTS:

- Average: 6 or more words
- Good: 8 or more words
- Outstanding: 9 or more words

ACROSS

- 6 Utter boredom (5)
- 7 Overtly theatrical or histrionic (8)
- 10 Urges rather strongly (7)
- 11 Capable of being read (7)
- 12 Cupboard; chest of drawers (7)
- 13 Trembles with cold or fear (7)
- 14 Author of "Cracking India" (5,6)
- 19 Surat's state (7)
- 21 Pear-shaped tropical fruit (7)
- 23 Slope (7)
- 25 Wrestling hold (7)

DOWN

- 1 Falling (2,3,3)
- 2 Headwear for bishops (6)
- 3 Limitation, check (10)
- 4 Shout (4)
- 5 Responsible (6)
- 6 Alters (6)
- 8 Utter misery (7)
- 9 Sumptuous meal (5)
- 13 She made her debut with Nishant (5,5)
- 15 Bashes (7)
- 16 Edible shellfishes or mollusks; omers (8)
- 17 Once more (5)
- 18 Karl Umrigar for one. Pesi Shroff for another (6)
- 20 Strait - _____: restrictive measures, in a way? (6)
- 22 Out of sight, out _____? (2,4)
- 24 One in Bonn (4)

CAPTION THIS!



Calling all our readers to caption this picture!

Send in your captions at editor@parsi-times.com by 8th December, 2021.
 Winning Caption and Winner's Name Will Be Published Next Week.

WINNING CAPTION!!!



Baby Monkey: Mommy, did these humans evolve from us monkeys?
 Mommy Monkey: Don't know what Darwin was smoking! Humans are such junkies!!

By Benaifer J. Bhadha (New Zealand)

Disclaimer: Some of our 'Caption This' Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous vein, which is the mainstay of the Parsi spirit! No offence is intended to anyone or any situation.

BAWAJI BHEJA FRY ANSWERS Across: 6 Ennui, 7 Operatic, 10 Exhorts, 11 Legible, 12 Dresser, 13 Shivers, 14 Bansi Sidhwa, 19 Gujarat, 21 Avocado, 23 Incline, 25 Armblock, 26 Helsinki, 27 Needy. DOWN: 1 On the ebb, 2 Mitres, 3 Constrain, 4 Yell, 5 Liable, 6 Emends, 8 Anguish, 9 Feast, 13 Smita Panti, 15 Parties, 16 Abalones, 17 Again, 18 Jockey, 20 Jacket, 22 Of mind, 24 Etne.

પારસી ટાઈમ્સ

VOLUME 11 - ISSUE 34 • Saturday, 04 Dec, 2021 - FRI, 10 Dec, 2021 • English Gujarati Weekly • Mumbai • PAGE 10 • Price 8/-

THE TRUTH. DELIVERED WEEKLY.

રતન ટાટાએ સ્ટાર્ટ-અપ ગુડફેલોનું સમર્થન કર્યું



સ્ટાર્ટ-અપનું બેકઅપ લેવા માટે જાણીતા ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાએ તાજેતરમાં બીજા સ્ટાર્ટ-

અપનું સમર્થન કર્યું છે - ગુડફેલો - જે આંતર-પેઢીને મિત્રતા પ્રદાન કરે છે અને પોતાને કમ્પેનિયનશિપ કંપની કહે છે.

શાંતનુ નાયડુ દ્વારા સ્થપાયેલ, જેઓ હાલમાં રતન ટાટાના



વ્યવસાય સહાયક છે, ગુડફેલો હાલમાં બીટા પરીક્ષણના તબક્કામાં છે, અને છેવટે વૃદ્ધ લોકોને સાથીદારી પ્રદાન કરવા માટે ૩૦ વર્ષથી ઓછી વયના સ્નાતકોની ભરતી કરવાનું વિચારે છે. સ્નાતકો, જેને ગુડફેલો કહેવાય છે, તેઓ વૃદ્ધોને મિત્રતા પૂરી પાડશે અને તેમની સાથે ચાલવા જવું, કરિયાણાની ખરીદી, ડોક્ટરની મુલાકાત, બેંકનું કામ, તેમને ટેકનોલોજી શીખવવી, અને તેમને કાગળ અને ઈ-મેઈલમાં મદદ કરવી જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે તેમની સાથે રહેશે. શાંતનુના કહેવા પ્રમાણે, ફક્ત ગ્રાન્ડપાલ્સ સાથે સમય પસાર કરો.

સ્ટાર્ટ-અપ જાન્યુઆરી, ૨૦૨૨માં વ્યાપારી કામગીરી શરૂ કરે તેવું લાગે છે. એકવાર લોન્ચ થયા પછી, ગુડફેલો માસિક સબ્સ્ક્રિપ્શન ચાર્જ કરશે. ગુડફેલો જે રીતે ઓફર કરે છે તે રીતે સાથી અને હૂંફ સાથે એકલા રહેતા વૃદ્ધોને મદદ કરવા માટે આંતર-પેઢીની મિત્રતા એ એક પ્રકારની, અર્થપૂર્ણ અને અધિકૃત રીત છે. હું ગુડફેલો કેવી રીતે આગળ વધે છે તે જોવા માટે ઉત્સુક છું અને શાંતનુ અને તેની યુવા ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, રતન ટાટાએ ઈ-મેઈલ કરેલા નિવેદનમાં શેર કર્યું.

એરબીએનબી, બોમ્બે હેમ્પ કંપની, બ્લ્યુસ્ટોન, ગોકવી, આઈક્યોર, નેસ્ટએવે, પેટીએમ અને ઓલા ઈલેક્ટ્રિક સહિત લગભગ ૫૦ સ્ટાર્ટ-અપને ફંડ આપ્યું છે. લેન્સકાર્ટ અને અર્બન લેડર - જ્યારે તેમાંથી કેટલાક યુનિકોર્ન બન્યા - સ્ટાર્ટ-અપ માટેનો એક શબ્દ જેની કિંમત ૧ બિલિયનથી વધુ છે. વિશ્વના અગ્રણી પરોપકારીઓમાંના એક અને સમુદાયના અગ્રણી તરીકે ઓળખાતા, રતન ટાટા ઈલેક્ટ્રિક વાલનોથી લઈને આરોગ્યસંભાળ અને ગતિશીલતા સુધીના પરોપકારી કારણો ધરાવતી કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે.


પારસી - ગઈકાલ અને આજ!

પારસી ઇતિહાસ સ્પષ્ટપણે પૂર્વ-એતિહાસિક અને એતિહાસિકમાં વિભાજિત કરી શકાય છે. આપણે પૂર્વ-એતિહાસિક સમય વિશે દંતકથાઓ, અને અમુક ધાર્મિક ગ્રંથોમાંના સંદર્ભો વિશે જાણીએ છીએ. એતિહાસિક સમયગાળો ઈરાનના શિલાલેખમાં તેમજ ગ્રીક અને પછી આરબ ઇતિહાસકારો દ્વારા નોંધાયેલ છે.

હેરોડોટસ (૪૮૪-૪૨૫ બીસી), પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર, ધ હિસ્ટોરીઝમાં ગ્રીકો-પર્સિયન યુદ્ધોનું વિગતવાર વર્ણન લખે છે, જ્યાં તેમણે એતિહાસિક ઘટનાઓની વ્યવસ્થિત તપાસની પહેલ કરી હતી. હેરોડોટસ પર્સિયન રિવાજોનું વર્ણન કરે છે જે લગભગ અઢી હજાર વર્ષ પહેલાં (લગભગ ૪૩૦ બીસીઈ) સુસા અને અન્ય પર્સિયન ગઢમા નિષ્ણાત માનવામાં આવતી હતી. તે પર્સિયનોના વર્તન અને મૂલ્યોને ગ્રીક લોકો સાથે વિરોધાભાસ આપે છે, અને પર્સિયનોને તે વધુ અનુકૂળ આવે તેવું લાગે છે. પરંતુ તે એમ પણ ઉમેરે છે, એવું કોઈ રાષ્ટ્ર નથી કે જે પર્સિયન તરીકે વિદેશી રિવાજોને સરળતાથી અપનાવે. આ વાત આજે પણ એટલી જ સાચી છે.

પૂજા: હેરોડોટસ લખે છે કે હું જે પર્સિયન રિવાજોનું અવલોકન કરું છું તે નીચે મુજબ છે: તેમની પાસે દેવતાઓની કોઈ છબી નથી, મંદિરો કે વેદીઓ નથી, તેનો ઉપયોગ મૂર્ખાઈની નિશાની માનવામાં આવે છે. તેઓ સૂર્ય અને ચંદ્રને, પૃથ્વીને, અગ્નિને, પાણીને અને પવનને અર્પણ કરે છે. આ એકમાત્ર એવા દેવતાઓ છે જેમની પૂજા પ્રાચીન કાળથી તેઓ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, પર્સિયનો કુદરતની આદર કરતા હતા અને કુદરત દ્વારા કુદરતના સર્જક તરફ જોતા હતા. અજાયબીની વાત છે કે આપણે તે સમયગાળામાં દેવતાઓની કોઈ છબીઓ જોતા નથી અથવા તે બાબત માટે જરથુષ્ટ્રની છબી પણ નહોતી. આજે, તેનાથી વિપરિત, જરથુષ્ટ્રની છબીઓ (જોકે ખરેખર કોઈ જાણતું નથી કે જરથુષ્ટ્ર કેવા દેખાતા હતા) અને અન્ય પવિત્ર વ્યક્તિઓ ઝોરાસ્ટ્રિયન ઘરો અને આતશ મંદિરોને શણગારે છે.

જન્મદિવસની ઉજવણી: હેરોડોટસ લખે છે કે વર્ષના તમામ દિવસોમાં, તેઓ જે સૌથી વધુ ઉજવે છે તે તેમનો



જન્મદિવસ છે. તે દિવસે ટેબલને તમામ પ્રકારના માંસ સાથે એમ્પ્લ સપ્લાય સાથે સજ્જ કરવાનો રિવાજ છે. તેઓ થોડો નક્કર ખોરાક ખાય છે સાથે મીઠાઈની વિપુલતા, ટેબલ પર થોડી વાનગીઓ હોય છે.

તેઓ વાઈનના ખૂબ શોખીન છે, અને તે મોટી માત્રામાં પીવે છે. હવે આપણે જાણી શક્યા છીએ કે માંસ, મીઠાઈઓ અને વાઈનનો આપણો ક્યાંથી આવ્યો છે!

નિર્ણય લેવો: હેરોડોટસ અનુસાર, પર્સિયનોની નિર્ણય લેવાની એક અનોખી રીત હતી. તે લખે છે કે તેઓ જ્યારે દારૂના નશામાં હોય ત્યારે વજનની બાબતો પર ઈરાદાપૂર્વક વિચારવાની તેમની સામાન્ય પ્રથા છે; અને પછી કાલે, જ્યારે તેઓ શાંત હશે, ત્યારે તેઓ જે નિર્ણય પર પહેલા રાત્રે આવ્યા હતા તે ઘરના માસ્તર દ્વારા તેમની સમજા મૂકવામાં આવે છે અને જો તે પછી તેને મંજૂર કરવામાં આવે, તો તેઓ તેના પર કાર્ય કરે છે; જો નહિ, તો તેઓ તેને બાજુ પર રાખે છે. કેટલીકવાર, જો કે, તેઓ તેમના પ્રથમ વિચાર-વિમર્શમાં શાંત હોય છે, પરંતુ આ કિસ્સામાં, તેઓ હંમેશા વાઈનના પ્રભાવ હેઠળ આ બાબત પર પુનર્વિચાર કરે છે.

કદાચ બોમ્બે પારસી પંચાયતના ટ્રસ્ટીઓએ આ પ્રયાસ કરવો જોઈએ! અનુકૂલન કરવા માટે ઝડપી:

હેરોડોટસ લખે છે: કોઈ રાષ્ટ્ર નથી જે પર્સિયન તરીકે વિદેશી રીત-રિવાજોને સરળતાથી અપનાવે છે. આમ, તેઓએ મેડીસનનો પોશાક લીધો છે, તેને તેમના પોતાના કરતા શ્રેષ્ઠ માનીને અને યુદ્ધમાં તેઓ ઈજિપ્તની બ્રેસ્ટપ્લેટ પહેરે છે. તેઓ કોઈપણ લકઝરી

વિશે સાંભળે છે, તેઓ તરત જ તેને પોતાનું બનાવી લે છે અને તેથી, અન્ય નવીનતાઓમાં, તેઓએ ગ્રીક લોકો પાસેથી અકુદરતી વાસના શીખી છે. તેમાંથી દરેકની ઘણી પત્નીઓ છે, અને હજુ પણ મોટી સંખ્યામાં ઉપપત્નીઓ છે. શસ્ત્રોમાં પરાક્રમની બાજુમાં, તે ઘણા પુત્રોના પિતા હોવાને મેનવી શ્રેષ્ઠતાનો સૌથી મોટા પુરાવા તરીકે ગણવામાં આવે છે. દર વર્ષે રાજા એવા માણસને સમૃદ્ધ ભેટો મોકલે છે જેણે સૌથી વધુ સંખ્યા બનાવી હોય છે કારણ કે તેઓ આ સંખ્યાને તાકાત તરીકે ધરાવે છે.

જ્યારે પારસીઓ ભારતમાં આવ્યા, ત્યારે તેઓ તેમના પર્સિયન પૂર્વજોના પગલે ચાલ્યા. આપણે ભારતીય પહેરવેશ, ગુજરાતી ભાષા વગેરે અપનાવ્યા. મોટા પરિવારોને ઉછેરવાની બાબતમાં પણ અમે સારું કર્યું જ્યાં સુધી શહેરીકરણને કારણે મોટા સંયુક્ત પરિવારો તૂટી ગયા.

પ્રારંભિક શિક્ષણ: હેરોડોટસ લખે છે કે તેમના પુત્રોને તેમના પાંચમાથી તેમના (વધુ માટે જુઓ પાનુ ૧૧)

મિત્રો, સામાન્ય રીતે ૬૦ વર્ષની ઉંમરે પહોંચીએ એટલે આપણે માની લઈએ છીએ કે, હવે આપણા આરામના દિવસો આવી ગયા છે. ફક્ત આટલું જ નહીં સમાજ પણ એવું માને છે કે, ૬૦ ની વય શરૂ થાય છે એટલે તમે તમારી બધી જવાબદારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે તમે મુક્ત થઈ ગયા છો. આ સમય એવો હોય છે કે, જ્યારે તમારે તમારી જાત સાથે વધુ ને વધુ સમય વિતાવવાનો હોય છે.

પરંતુ, આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે સક્રિય જીવન જીવો છો. તો ચાલો આપણે જાણીએ કે ૬૦ વર્ષની વયે પણ પોતાની જાતને કેવી રીતે ફિટ રાખવી. જો તમે તમારા દિમાગથી જીવન છો, તો તમારું શરીર પણ તમને ટેકો આપવા તૈયાર હશે, પરંતુ જો તમે એવું વિચારશો કે તમારી ઉંમર હવે આ બધી બાબતો માટે નથી, તો મારો વિશ્વાસ કરો, તમે ફક્ત ઘરેથી હોસ્પિટલમાં જતા રહેશો. તમારા મનથી સકારાત્મક બનો અને નક્કી કરો કે તમે વૃદ્ધ નથી.

જો તમે હૃદયથી યુવાન થવાનું સ્વીકારો છો, તો પછી શરીરને સ્વસ્થ અને ફિટ રાખવાનું સરળ બને

હૃદયથી યુવાન થવાનું સ્વીકારો

છે. નિવૃત્તિ પછી, તમારા પોતાના સ્વાસ્થ્ય પર ખર્ચ કરો. સ્વસ્થ ખોરાક, વ્યાયામ, યોગ અને વોકિંગની આદત રાખો. આ માટે, તમે નિષ્ણાતની સલાહ લઈ શકો છો. તમે તમારા રૂટીનનું પાલન કરો એટલે તમે અવશ્ય યુવાન દેખાશો, વૃદ્ધાવસ્થા તમને સ્પર્શશે પણ નહીં.

નાની અથવા મોટી કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાને અવગણશો નહીં. નિયમિતપણે તમારા બોડીનું ચેકઅપ કરાવતા રહો. તમારા પોતાના પર ખર્ચ કરવાને વધારાનો ખર્ચ ગણશો નહીં. જો તમે યોગ્ય સમયે ડોક્ટર સાથે તમારી સમસ્યાઓ વિશે ચર્ચા કરો છો, તો તમારા ખર્ચ પણ ઓછા થશે.

આ યુગના લોકો માટે સૌથી મોટી સમસ્યા એકલતાની છે. આવી સ્થિતિમાં તમે તમારું પોતાનું એક જૂથ બનાવો. તમારી ઉંમરના લોકો સાથે બગીચામાં બેસો અને મજા કરો. અહીં તમે સમાજ,

કુટુંબ અને તમારા વિશે વાત કરી શકો છો. આમ, કરવાથી તમે જોશો કે તમે પહેલા કરતા પણ વધારે ખુશ અને સકારાત્મક બનશો.

જો તમે ફિટ અને તંદુરસ્ત રહેવા ઈચ્છતા હોવ તો તમારે તમારા ખાણીપીણીની ખાસ કાળજી લેવાની જરૂર છે. જો તમે સારા સ્વાસ્થ્યની સાથે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખશો તો તમારું શરીર એકદમ નીરોગી રહેશે.

તમારા ખોરાકમાં ઘણાં ફળો, લીલા શાકભાજી, તેલયુક્ત માછલી અને આખા અનાજનો સમાવેશ કરો. આ ઉપરાંત તમે

તમારા આહારમાં હળવા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરી શકો છો. સંતૃપ્ત ચરબી ટાળો. પાચનશક્તિ એક ઉંમર પછીની જેટલી મજબૂત હોતી નથી. આવી સ્થિતિમાં કૃપા કરીને ડોક્ટરની સલાહ લો. તમારા માટે પુષ્કળ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારા શરીરને ડિહાઈડ્રેટ રાખશે અને તમને થાક લાગશે નહીં. ખાંડવાળી ચીજોથી શક્ય તેટલા દૂર રહો. જો તમે આ બધી કાળજી રાખશો તો તમે ૬૦ પછી પણ નીરોગી સ્વાસ્થ્ય મેળવી શકશો.



હવાનો એક જોરદાર આવ્યો ઝોકો, ખરી પડ્યું રે એક સુંદર મઝાનું કોમળ ફૂલ



બધાં કહે, સમય પાકી ગયો, એટલે થાય આવું, રામજીથી થાય નહીં કોઈ ભૂલ લાડકી હતી બહુજ, એ એના ભાઈઓની; ભાઈ હતા એ બેનીના પાંચ પાંચ; એટલે લાગતું હતું એને, એમની છાવમાં કદી એના માથા ઉપર આવશે નહીં કોઈ આંચ પતિના જવા પછી પણ, રહેશે પ્રેમ એમનો એના ઉપર, પણ હતી એ બિચારીની, આં એક મોટી ભૂલ જમાના આં ધીનોનાં વર્તાવથી, વાગવા લાગ્યા હવે એને રોજ કેટલાયે કંટક, ચુભિયા શૂળ કડવી સચ્ચાઈ હવે આવી એની સમજમાં, ભાઈઓ ભાભીઓ ધીરથી ગયાં ખસી એની બેહપનીએ બી વિચાર્યું, આં ઝમેલમાં, આવમાં વળી હું ક્યાં ફસી ! ધીરે ધીરે બધાં થઈ ગયા દૂર, નહીં મળી એને કોઈ જાતની હૂંફ, ન મળ્યો કોઈ આધાર હાં, આવતા રહ્યા કોઈ કદાચ એને ફોન, ખેર ખબર પૂછવા; પણ હકીકતમાં હતી એ નિરાધાર લાગવા લાગ્યું એને, માં બાપ સિવાય, દુનિયામાં શું સાચેજ કોઈ પોતાનું હોતું નથી શું ભાઈઓ ત્યાં જઈ, અમેરિકન થઈ ગયા; શું એને સંભાળવાની, એમની કોઈ ફરજ ન હતી માં બાપના આપેલા સંસ્કાર આમ કોઈ કેવી રીતે ભૂલે, એ તો એને સમજાયું જ નહીં પણ હવે એ ખુશ હતી, છોકરાં એના, હવે કમાતા થઈ ગયા હતા, એમને કોઈની જરૂર રહી નહીં જીવનની કડવી સચ્ચાઈ સમઝી એનું દિલ રોઈ ઉઠ્યું, લાગણીઓ એની જાણે મરી પરવાડી બાળપણના સ્વપ્ન છિત્રભિન્ન થઈ ગયા હતા, એની લાગણીઓ કૂણી મરી પરવાડી યાદ આવ્યું એને આં ગીત, હૈ મતલબ કી દુનિયા સારી, યહાં કોઈ કિસીકા યાર નહીં, યહાં કિસીકો સચ્ચા પ્યાર નહીં.

- એ. એફ. દસ્તુર

પારસી - ગઈકાલ અને આજ (પાના નં. ૧૦થી ચાલુ)

વીસમા વર્ષ સુધી, ત્રણ બાબતોમાં કાળજીપૂર્વક સૂચના આપવામાં આવે છે - સવારી કરવી, ધનુષ્ય દોરવું અને સત્ય બોલવું. તેમના પાંચમા વર્ષ સુધી તેમને તેમના પિતાની નજરમાં આવવાની મંજૂરી નથી, પરંતુ તેઓ મહિલાઓ સાથે તેમનું જીવન પસાર કરે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે, જો બાળક નાની ઉંમરે મૃત્યુ પામે છે, તો પિતાને આ નુકસાનથી પીડિત ન થાય. તે ઉમેરે છે, તેઓ જે કંઈપણ કરવા માટે ગેરકાનૂની છે તેની વાત કરવી ગેરકાયદેસર માને છે. વિશ્વની સૌથી શરમજનક વસ્તુ, તેઓ વિચારે છે, જૂઠું બોલવું છે; પછીનું સૌથી ખરાબ, દેવું લેવું, કારણ કે, અન્ય કારણોસર, દેવાદાર જૂઠું બોલવા માટે બંધાયેલો છે. સત્ય બોલવું અને પ્રામાણિક જીવન જીવવું એ મૂળભૂત પારસી મૂલ્ય છે.

અશુદ્ધ કરવા માટે નહીં: હેરોડોટસ લખે છે કે તેઓ તેમના શરીરના આવથી નદીને ક્યારેય અશુદ્ધ

કરતા નથી, અને તેમના હાથ પણ ધોતા નથી; કે તેઓ અન્ય લોકોને તેમ કરવા દેશે નહીં, કારણ કે તેઓ નદીઓ માટે ખૂબ જ આદર ધરાવે છે. ત્યાં એક અન્ય રિવાજ છે જે અનામત સાથે બોલાય છે, અને જાહેરમાં નહીં, તેમના મૃતકો વિશે. એવું કહેવાય છે કે પુરૂષ પરિધનના શરીરને ત્યાં સુધી દફનાવવામાં આવતું નથી, જ્યાં સુધી તેને કૂતરા અથવા શિકારી પક્ષી દ્વારા ફાડી ન ખવાય.

આમ, પારસી લોકો લગભગ પચીસ સદીઓથી આકાશ દફન (શબને કુદરતના તત્ત્વો સાથે ખુદ્દા મુકીને) કરતા હોવાનું જણાય છે. પાણીનું પૂજન કરવું એ પણ જીવંત પરંપરા છે.

અન્ય રિવાજો: હેરોડોટસ દાવો કરે છે: માગી એક ખૂબ જ વિલક્ષણ જાતિ છે, જે ઈજિપ્તના પાદરીઓથી સંપૂર્ણપણે અલગ છે, અને ખરેખર અન્ય તમામ પુરુષોથી અલગ છે. ઈજિપ્તીયન પાદરીઓ તે બલિદાનમાં આપેલા પ્રાણીઓ સિવાય

કોઈપણ જીવંત પ્રાણીઓને મારી ન નાખવાનો ધર્મનો મુદ્દો બનાવે છે.

માગી, તેનાથી વિપરિત, કુતરા અને માણસોને બાદ કરતાં તમામ પ્રકારના પ્રાણીઓને પોતાના હાથે મારી નાખે છે. તેઓ રોજગારમાં આનંદ અનુભવતા હોય તેવું લાગે છે, અને અન્ય પ્રાણીઓ, કીડીઓ અને સાપ અને જેમ કે ઉડતી અથવા વિસર્પી વસ્તુઓની જેમ સરળતાથી મારી નાખે છે. જો કે, આ હંમેશાથી તેમનો રિવાજ રહ્યો છે, તેથી તેમને તે ચાલુ રાખવા દો. બજારમાં ખરીદી અને વેચાણ એ પરિધનો માટે અજાણ્યો રિવાજ છે, જેઓ ક્યારેય ખુદ્દા બજારોમાં ખરીદી કરતા નથી, અને ખરેખર તેમના આખા દેશમાં, એક પણ બજાર-સ્થળ નથી.

ઈતિહાસનો પાઠ: એવું લાગે છે કે આપણે હજી પણ ઘણા રિવાજો અને પરંપરાઓનું પાલન કરીએ છીએ. કેટલાક અન્ય આપણે અનુકૂલિત

કર્યા છે અને કેટલાક આપણે સંપૂર્ણપણે દૂર કર્યા છે. સમગ્ર માનવ ઈતિહાસમાં, સમુદાયો કે જેઓ તેમની સમૃદ્ધ પરંપરાઓ અને સંસ્કૃતિને વફાદાર રહ્યા છે, તેમજ તેમના પ્રસિદ્ધ પૂર્વજોના મૂલ્યો અને નીતિશાસ્ત્રને પણ આત્મસાત કર્યા છે, તેઓ મજબૂત અને ગતિશીલ રહ્યા છે.

કોર્પોરેટ જગતમાં પણ, સૌથી અસરકારક સંસ્થાઓ એવી છે જે પરંપરા, સંસ્કૃતિ, મૂલ્યો અને નીતિશાસ્ત્રનો આદર કરે છે અને ઉજવણી કરે છે. તે કોઈ સંયોગ નથી કે આમાંની કેટલીક અત્યંત પ્રશંસનીય કોર્પોરેશનો પણ સૌથી વધુ નફાકારક છે.

જેમ સંસ્થાઓ સાથે, તેમ સમુદાયો સાથે. જે સમુદાય પરંપરા, સંસ્કૃતિ, મૂલ્યો અને નૈતિકતાનો આદર કરે છે અને ઉજવણી કરે છે, તે મજબૂત અને ગતિશીલ રહે છે.

- નોશીર એચ. દાદરાવાલા

अेक नजर पारसी मरणो उपर

Deceased मरनार	Age वय	Date तारीख	Address र. ठे.	Relations सगाथीओ
Dolly Bomanshaw Daver दोली बमनशाह दावर	93 ९३	28.11.2021	17/B, Rustom Baug, Sant Savta Marg, Byculla East, Mumbai 400 027. १७/बी/१२ इस्तम बाग, संत सावता मार्ग, बायजवा, मुंबई-४०००२७.	ते मरुमो भोरशेदवानु तथा बमनशाह बमशेदज दावरना दीकरी ते मरुमो सील्वा, दीना, बर जमी हटरीया, जरीन पेसी संभाषा ने गुवना बलेन ते नेवीव पेसी संभाषा, दोगडो नेवीव संभाषा, शाहजुभ पेसी संभाषा, नवाज शाहजुभ संभाषा ने हुकरीश वोराना मासीज ते नवरोज, अनीश, रोहान, मेहरजीन अरजान भंवाता, योहान ने डेरीनाना ग्रेन्ड मासी.
Gohar Dinshaw Shahparast गोहर दीनशाह शाहपरस्त	81 ८१	28.11.2021	272-A, CONTRACTOR BUILDING, DR. B. A. AMBEDKAR ROAD, PAREL, MUMBAI 400 012. २७२-अ, कन्ट्रैक्टर बिल्डिंग, डॉ. बी. अ. रोड, परेल, मुंबई-४०००१२..	ते मरुमो दीनशाह इस्तम शाहपरस्तना विधवा ते बेहनाज अ. धरानी, बेहराम डी. शाहपरस्त, नरीमन जोहराबी तथा मरुमो रोहिनटन डी. शाहपरस्तना माताज ते मरुमो शीरीन तथा इस्तम जोहराबी अलीयाबादीना दीकरी ते जरीर र. धरानी, मोडी दीचिरा तथा डेसी न. जोहराबीना सासुज ते इराल अ. धरानी तथा रोहान अ. धरानीना ममथीज ते शनाया न. जोहराबी ना अपथीज ते मरुमो शीरीयार र. जोहराबी, भारमन जोहराबी, मोरवरीद जोहराबी, वाणीज जोहराबी, बमशेद जोहराबी तथा जोदादाद जोरमदीनना बलेन ते डेकी, महवश, रोमीन, इस्तम, लुशंग, शाहजुभ, जहांगीर, मीना, महजुभ, डेती, बानु तथा जहांगीरना आंटी ते परीचर दीनशाह, जेहान, जुदामुसाद, अरुपनदीयार, डेरसी, बेहराम, बानु, अही तथा सोहराबना सीस्तर-धन-वो ते मरुमो दीवत तथा इस्तम स. शाहपरस्तना वडु ते डीयारा क. वाडयाना ग्रेट ग्रान्ड मधर.
Pervin Jimmy Wadia परवीन जमी वाडीया	75 ७५	28.11.2021	20 A, Talukdar Building, 2Nd Floor, Room No. 8, Marzban Colony, 'A. R. Nair Road, Jacob Circle, Mumbai 400 011. २०-अ, ताळुकर बिल्डिंग, २जे माणे, ३. नं. ०८, मरुजबान कोलोनी, मुंबई - ११	ते जमी पीरोजशाह वाडीयाना धणुयानी ते मरुमो भोरशेद अने डेकी बरजोरज दारबाना दीकरी ते नोशीर, अहद, रोशन, दोवीना बलेन ते मरुमो पीरोजशाह अने दीनामाथी वाडीयाना वोथी ते दीनशाह पीरोजशाह वाडीया तथा ते मरुमो दादी पीरोजशाह वाडीयाना भाभी ते रतीना देरानी ते रोशन अहद दारबाना नरन.
Jerbanoo Darabsha Damania जरबानु दारबशा दमनीया	86 ८६	29.11.2021	Chemox House, Block No. 8, 2Nd Floor, Dhobhi Talao, Near Bombay Hospital, Mumbai 400 020 डेमोकस हाउस, ब्लॉक नं. ८, दोबो माणे, धोबीतलाव, बोम्बे होस्पिटलवनी पास, मुंबई-२०.	ते मरुमो बानुबाथी तथा जहांगीर दीनशाह इस्तमना दीकरी ते दारबशाह शावकशाह दमनीयाना धणुयानी ते मेहर मेहरनोश छोथी तथा अरनावाज दारबशाह दमनीया, ते मरुमो जहांगीर दारबशाह दमनीया तथा डेकी इरोष लीवुना माताज ते पेरीन सोवी ओन्जिनियर, धनजशाह इस्तम, नोशीर इस्तम तथा मरुमो दोवी डीरोज बाना ने मरुमो अरुष जहांगीर इस्तमना बलेन ते मरुमो दीनबाथी तथा सावकशाह दमनीयाना वडु ते इरोष नवल लीवु तथा मेहरनोश मानेकशाह छोथीना सासुज ते मरुजान, सववट, जुभीन कमल, देवशान शाहनाज, शहाजहाद, आदीव, आमीन, रहेना, परीनाजना मोटा ममथीज ते धीती, रोहीनतन मास्टर, सरोश इरामरोज, जमी, इरीदा ने डेटी, इरालना मासीज ते जडु नोशीर करनजयाना नरद.
Rustom Merwan Unani इस्तम मेरवान युनानी	82 ८२	29.11.2021	E-16, SHAPUR BAUG, 376, V. P. ROAD, GIRGAON, MUMBAI 400 004. ई-१६, शापुर बाग, ३७६ वी. पी. रोड, गीरगाव, मुंबई - ४००००४.	ते मरुमो अरनवाज अने मेहरवानज इस्तमज युनानीना दीकरा ते मरुमो जमी तथा अरवद इरेदुन दाराबज दस्तुरना जमाथी ते गुवना भाविंद ते रोहीनतन अने डीरुजा इराल करकरीयाना पण्या ते आजमीन युनानी अने अरवद इराल करकरीयाना ससरज ते अरवद जेहान करकरीयाना ममावाज ते मरुमो गुव, लोमी दीरज भोरशेद, शरवी इस्तम ताता, ग्रेस सावक भंवाता अने रोशन युनानीना भाथी ते अरवद इरोष इरेदुन दस्तुर, आबान तेहमुव बानज, अरवद अरुपी इरेदुन दस्तुर अने दीवत मानेक दस्तुरना बनेवी.
Rustom Jehangir Irani इस्तम जहांगीर इरानी	79 ७९	30.11.2021	Homai Abad, 240 Linking Road, Petrol Pump, Bandra (West), Mumbai 400 050. होमाय आबाद, २४० लींकिंग रोड पेट्रोल पम्प, बान्द्रा (वे.), मुंबई-५०.	ते पुरीन इस्तम इरानीना धणुी ते मरुमो जहांगीर अने पीरोज इरानीना दीकरा ते लोरमजद अने गुवना इस्तम इरानीना भावाज ते अरनावाज लोरमज इरानी अने मीनोचर तीरंदाज इरानीना ससरज ते रोशन, दानेश, नेवीव, आवाना अपावाज ते मरुमो वाणीदना भाथी ते मरुमो शीरीयार अने होमाय इरानीना जमाथी.
Tehmina Noshir Elavia तेहमीना नोशीर अेलावीया	89 ८९	1.12.2021	Ushita Te Chs, Room No. 2, Jehangir Daji Street, Grant Road, Mumbai 400 007. उस्ता ते को.ओप.हा. सोसायटी, रूम नं. २, जहांगीर, मुंबई-७.	ते मरुमो नोशीर इस्तमज अेलावीयाना धणुयानी ते मरुमो जवेबर तथा शेहेरा तीजेरीवावाना दीकरी ते इरीदा लोशंग वांदरीवावाना माताज ते लोशंग लोमी वांदरीवावाना सासुज ते पेरीन, मेहेड, अरुपी तथा मरुमो दीनुना बलेन ते मरुमो इस्तमज अने बीजामाथी अेलावीयाना वोथी.
Perin Peshotan Rustomjee पेरीन पेशोतन इस्तमज	85 ८५	1.12.2021	Naju Manor, 14, Oliver Street, Colaba, Mumbai 400 039. नाजु मानोर, १४ ओलीवर जल्वी, कोलाबा, मुंबई४०००३९.	ते मरुमो पेशोतन इस्तमजना धणुयानी ते मरुमो शीयावाक अने मनीजेल दादुवावाना दीकरी ते नाजनीन जव थानावावा अने शीराज पी. इस्तमजना माताज ते जव साम थानावावा अने रोसावीन्द इस्तमजना सासुज ते जव, सापरस, रीहानना ममथीज ते जडु मनोचा तथा मरुमो (डी.) जमी दादुवावाना बलेन ते मरुमो तेहमुरस अने धनमाथी इस्तमजना वोथी.
Ervad Bomi Ardeshir Vaid अेरवड बोमी अरदेशर वैद	76 ७६	1.12.2021	Flat No. 3, Sea Belle, Nepean Sea Road, Mumbai 400 006. इवेट नं. ३, सीबेले, नेपीयन्सी रोड, मुंबई४००००६.	ते दिल्वा बोमी वैदना भाविंद ते मरुमो गुवबथी तथा अरदेशर बमशेदज वैदना दीकरा ते बेहराम बोमी वैद, इरजान बोमी वैद ने आवान बोमी वैदना भावाज ते रोशनी बेहराम वैद, मीनल इरजान वैद, योगेश कृष्ण मोडकना ससरज ते मेहर, बेनाइशा, मनोमथी, इरशाद समननाज ने रेलानना ग्रेन्ड इधर ते मरुमो इसी अरदेशर वैदना भाथी ते मरुमो दीना तथा नादेशर अेदरज इटाकीयाना जमाथी ते लोमीयार नादेशर इटाकीयाना बनेवी.
Aban Beji Bajan आबान बेज बेजान	82 ८२	3.12.2021	Subash Ward, Katni M.p. Badhaiya Kheda, Mohas Jabalpur, Madhya Pradesh 483 501 सुबाष वार्ड, कातनी अेम.पी. बुधानीया जेडा, मोहस जवबपुर, मध्य प्रदेश ४८३५०१.	ते मरुमो ओस्ता बजना धणुयानी ते मरुमो नरगेश अने दीनशाह वरीवानी दीकरी ते जडु डेरसी मोदी अने डीरोजा, जरीर दवावना मम्मा ते अनुडका, रीयाज, आरीयाना जोथी, इकशादना ममथीज ते जडु इसी गोदाना बलेन ते मरुमो ओस्ता गुवबानु अने अेरवद डावसज बजानना वडु हते अेरवद दोराब बजान ने दीनु कोवंबेवावाना भाभी.

Death Announcements From Prayer Hall

Paurusasp Navroji Dabdi पौरुसस्प नवरोजी दाबडी	88 ८८	26.11.2021	Flat No. 502, 5th Floor, A Wing, Hilla Tower, Dr. S. S. Road, Lal Baug, Mumbai - 400012. इवेट नं. ५०२, ५मे माणे, अे विंग, हिल्वा टावर, डॉ. अेस. अेस. रोड, लावबाग, मुंबई ४०००१२.	ते दोवीना धणुी ते मरुमो धनमाय अने मरुमो नवरोजना दीकरा ते पेशोतन, जुरशीद, जसमीन अने मरुमो जहांगीरना पण्या ते नंदीनी, यजदीना ससर ते जुबीन, डायना, पर्व अने जेहानना ग्रान्ड इधर ते मरुमो बरजोर, डेनी, रतन अने आलुना भाथी ते मरुमो मानेकभाथी अने मरुमो लोरमसजना जमाथी.
Roshan Sohrab Jassawalla रोशन सोहराब जसावाला	104 १०४	30.11.2021	Cumballa Crest, Flat No. 201, Plot 42, Peddar Road, Mumbai 400026. कंबाला क्रेस्ट, इवेट नं. २०१, प्लॉट ४२, पेदर रोड, मुंबई ४०००२६.	ते मरुमो सोहराबना धणुयानी ते मरुमो आयमाथी अने डीरोजशा नगरवावाना दीकरी ते जव अने जरीनना मंमी ते डायना अने डेरीवना सासु ते समीर, अनीसा अने निणीवना ग्रेन्ड मधर ते मरुमो रती, मनी, जेहानगीर, नोशीर, तेहमुरस अने नरगीशना बलेन ते पीरोज, जरीर, जुरशेद, जव अने शेरनाजना आन्टी ते मरुमो मीठीभाथी अने जवना वडु.
Burjor Pirojshaw Minbatiwala बरजोर पीरोजशाह मीनबतीवाला	89 ८९	2.12.2021	Room No. 23, CM Banaji Bldg., Forjett Cross Lane, Gowalia Tank, Mumbai-400036. रूम नं. २३, सीअेम बनाज बिल्डिंग, फोरजेट क्रॉस लेन, गोवालीया टैंक, मुंबई-४०००३६.	ते श्रीतीना धणुी ते मरुमो पीरोजशाह अने मरुमो नरगीसना दीकरा ते डायनाना देसाथीना पण्या ते मरुमो नेवीलेना ससर ते डायनाना ग्रान्ड इधर ते मरुमो दीवनवाज अने मरुमो लोशंग, मरुमो डेनी अने मरुमो रोहीनटनना भाथी ते मरुमो जवामाय अने मरुमो पीरोजशाहना जमाथी.

Death Announcements From Poona

Khorshed Kersasp Patel भोरशेद केरसास्प पटेल	82 ८२	23.11.2021	B/25, Riviera Society, Phase II, Wanawadi, Pune-411040. बी/२५, रिविरा सोसायटी, डेज-२, वानावडी, पुणे-४०.	ते मरुमो केरसास्प पेशोतन पटेलना धणुयानी ते मरुमो नाजमांय अने पीरोजशाह इरामज दस्तुरना दीकरी ते मरुमो पीवांमाय अने पेशोतन शापुरज पटेलना वडुमाय ते जहांगीर, नोशीरवान अने मरुमो तेहमीना, दादीबा, शावकशाह, पेशोतन अने डेकोबादना बलेन ते परवेज अने मरुमो डीरोजीना भाभी ते इरोष, परसी अने लोरमजना मम्माज ते देल्ना, सीववी अने सनायाना सासुज.
Maharukh Jaal Bodhanwala महारुख जाल बोधानवाला	70 ७०	25.11.2021	Arna-Villa, Shrinagar Road, Ajmer (Raj). अरना-वीला, श्रीनगर रोड-अजमेर (राज.)	ते जव सोराबज बोधानवावाना धणुयानी ते मरुमो नरगेश-जवेबर-सतारावावाना दीकरी ते जवेबरज बोधानवावा-महाजरीन नरीमान अमवसाडीवाला तथा सनाया मजद जवेरीना माताज ते शेहरनाज बोधानवावा - नरीमान अमवसाडीवाला तथा मजद जवेरीना सासुज ते जरीर जवेबर सतारावावाना बलेन.

YOUR MOONSIGNS JANAM RASHI THIS WEEK

લખનાર: મરહુમ મહારાજ શ્રી સ્વયંજયોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

અઠવાડિક રાશિક્ષણ: તા. ૪.૧૨.૨૦૨૧ થી તા. ૧૦.૧૨.૨૦૨૧



Aries - મેષ - અ.લ.ઈ.

૨૫મી ડિસેમ્બર સુધી તો ગુરુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારાથી બીજાની ભલાઈનું કામ થઈ જશે. કોઈકના મદદગાર બની શકશો. ગુરુની કૃપાથી જાણતા અજાણતા કોઈક વ્યક્તિને સાચો રસ્તો બતાવીને તેનું દિલ જીતી લેશો. નાણાકીય મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો પાક પરવર દેગાર બનાવી દેશે. રોજ 'સરોશ યજ્ઞ' ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. ૫, ૭, ૯, ૧૦ છે.

Lucky Dates: 5, 7, 9, 10.

Jupiter's rule till 25th December will have you indulging in helpful acts for others. You will be able to be of use to others. Under the grace of Jupiter, you will also be able to show the right path to others and in the process, win over their hearts. The Almighty will show you a way out of your financial difficulties. Pray the Sarosh Yasht daily.



Cancer - કર્ક - ડ.હ.

બુધની દિનદશા ચાલુ હોવાથી બુદ્ધીથી જેટલા કામો કરશો તેમાં વધુ ને વધુ સફળ થઈ જશો. અટકેલા કામોને પૂરા કરવા માટે કોઈકની મદદ લેવી પડે તો મદદ લેવામાં જરાબી વાર નહીં લગાડો. જેબી કમાણી તેમાંથી થોડા ઘણી રકમને બચાવીને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળી રહેશે. હાલમાં 'મહેર નીઆયેશ' ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૫, ૬, ૭ ને ૧૦ છે.

Lucky Dates: 5, 6, 7, 10.

Under Mercury's ongoing rule, all the tasks that you do using your intelligence will bear you success. You might need another's help or support in restarting your stalled projects. You will be successful in saving a little money from your income and investing it profitably. You will receive news which will fill you with happiness. Pray the Meher Nyaish daily.



Libra - તુલા - ર.ત.

૨૬મી ડિસેમ્બર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી હાલમાં તમે જ્યાંબી કામ કરતા હશો ત્યાં ફેલોના ડંકા વગાડીને રહેશો. તમારા લીધે બીજાને ક્ષયદો થવાના ચાન્સ પૂરેપૂરા છે. નાના-મોટા જેબી કામ કરશો તેમાં પ્લાનિંગ બનાવીને કામ કરી શકશો. મનની વાત મનમાં રાખી નહીં શકો. ૩૪મું નામ 'યા બેસ્તરના' ૧૦૧વાર ભણજો.

શુકનવંતી તા. ૪, ૭, ૮ ને ૧૦ છે.

Lucky Dates: 4, 7, 8, 10.

The Moon's rule till 26th December will bring you lots of appreciation and fame at your place of work. You will be the reason that others also profit. You will meticulously plan all your tasks - small or big. You will not be able to hold back your thoughts. Pray the 34th Name, 'Ya Beshtama', 101 times.



Capricorn - મકર - ખ.જ.

તમારી રાશિના માલિક શનિના પરમમિત્રની દિનદશા ચાલતી હોવાથી તમારા દરેક કામો ખૂબ જ સારી રીતે પૂરા કરશો. પૈસાની જરાબી ખંચતાણ નહીં આવે. શુકની કૃપાથી જ્યાં તમારે ત્રણનો ખર્ચ કરવાના હશે ત્યાં ત્રીસનો ખર્ચ આવશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. બીજાને મદદ સારી રીતે કરશો. હાલમાં તમોબી 'બહેરામ યજ્ઞ' ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. ૫ થી ૮ છે.

Lucky Dates: 5 to 8.

Under the rule of Venus, you will be able to complete all your work effectively. There will be no financial shortage. Under the rule of Venus, you will end up spending ten times more than what you expected. But there will be no financial difficulties. You will be able to help others creditably. Pray to Behram Yazad daily.



Taurus - વૃષભ - બ.વ.ઉ.

હવે તો તમનેબી ગુરુ જેવા ધર્મના દાતા ગુરુની દિનદશા ચાલુ થયેલી છે તેથી ૨૫મી જાન્યુઆરી સુધીમાં તમારા કામની કદર થઈને રહેશે. નવા કામ શરૂ કરવામાં કોઈબી મુશ્કેલી નહીં આવે. નાના-નાના ધનલાભ મળવાથી ધનની મુશ્કેલીમાં નહીં આવો. તમારા ઉપર મુકેલ વિશ્વાસનો તે વ્યક્તિને સંતોષ મળે તેવા કામ કરી શકશો. હાલમાં દર રોજ 'સરોશ યજ્ઞ' ભણવાનું ચાલુ રાખજો. શુકનવંતી તા. ૪ થી ૭ છે.

Lucky Dates: 4 to 7.

The onset of Jupiter's rule till 25th January, 2022, brings in much adulation and praise for you as regards your professional work. There will be no obstacles in starting new ventures. Small sporadic incomes will help to keep away any financial shortcomings. You will be able to come through for those who have put their faith in you. Pray the Sarosh Yasht daily.



Leo - સિંહ - મ.ટ.

૧૮મી જાન્યુઆરી સુધીમાં બુધ તમારા કામને ખૂબ જ સારી રીતે પૂરા કરાવી આપશે. ધનની ચિંતા ઓછી કરવા માટે એકરૂઢા કામ કરવામાં જરાબી મુશ્કેલીમાં નહીં આવો. ધનલાભની સાથે નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. ગામ-પરગામ જવાથી તમને આનંદની સાથે ધન કમાવાનો ચાન્સ મળી રહેશે. રિસાયલી વ્યક્તિને મનાવી લેશો. હાલમાં 'મહેર નીઆયેશ' ભણવાનું ચાલુ રાખજો. શુકનવંતી તા. ૪, ૬, ૭, ૮ છે.

Lucky Dates: 4, 6, 7, 8.

Mercury's rule helps you complete all your works effectively till 18th January. To reduce your financial worries, working extra for added income will ensure that you don't fall into a financial crisis. A small promotion along with an increase in income is indicated. Travel abroad will help you earn an income while you enjoy yourself. You will be able to win over someone who is upset with you. Pray the Meher Nyaish daily.



Scorpio - વૃશ્ચિક - ન.પ.

આજ અને કાલનો દિવસ જ સૂર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી વડીલ વર્ગની સાથે મતભેદ પડી જશે. તમારું હાઈ પ્રેશર બધી જશે. બાકી દફી ડિસેમ્બરથી ૫૦ દિવસના માટે શીતળ ચંદ્ર ગરમ મગજને ખૂબ જ શાંત બનાવી દેશે. તમારા બગેલા કામોને સુધારી દેશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. નવા કામ કરી શકશો. 'યા રયોમંદ'ની સાથે 'યા બેસ્તરના' ૧૦૧ વાર ભણજો. શુકનવંતી તા. ૬ થી ૯ છે.

Lucky Dates: 6 to 9.

Today and tomorrow mark the last two days under the rule of the Sun. You could end up having arguments with the elderly. Your Blood Pressure could increase. The Moon's rule, starting 6th December, for the next 50 days, will help cool off the hot-headedness. All your stalled or spoilt works will get resolved. Financially, things will start looking up. You will be able to take on new projects. Pray the 96th Name, 'Ya Rayomand', along with the 34th Name, 'Ya Beshtama', 101 times each, daily.



Aquarius - કુંભ - ગ.શ.સ.

પહેલાં ત્રણ દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી કોઈની ખોટી પંચાતમાં પડી જતા નહીં. તમારી કોઈ ચીજવસ્તુ ગુમાઈ જાય તેની સંભાળ લેજો. બાકી દફીથી તમોને શુકની દિનદશા ભરપૂર સુખ આપશે. મનની નેક મુરાદ પૂરી થશે. આજથી દરરોજ 'બહેરામ યજ્ઞ' ભણજો. શુકનવંતી તા. ૯, ૧૦, ૧૧ છે.

Lucky Dates: 9, 10, 11.

You have the last three days under Rahu's rule. You are advised not to unnecessarily get into other's problems. Ensure that you do not misplace or lose your important items. Venus' rule starting from 6th December will bring you much happiness. Your desires will get fulfilled. Starting today, pray to Behram Yazad daily.



Gemini - મિથુન - ક.ઇ.ધ.

૨૬મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તેથી તબિયતની ખૂબ જ કાળજી લેવી પડશે. તમે જે થોડાબી બેદરકાર રહેશો તો મોટી મુસીબતમાં ફસાઈ જશો. હાલમાં નાણાંની ખંચતાણ વધી જશે. આવકના ઠેકાણા નહીં રહે. ખર્ચ એટલો થઈ જશે કે તમે પોતે પરેશાન થઈ જશો. સગાથી દૂર રહેજો. 'મોટી હપ્તન' ભણવાથી થોડીક શાંતિ મેળવશો. શુકનવંતી તા. ૪, ૮, ૯, ૧૦ છે.

Lucky Dates: 4, 8, 9, 10.

Saturn's rule till 26th December calls for you to take great care of your health. The slightest carelessness on your part could land you in big trouble. Financially, things could get a little tight. There will be no guarantee of income. Rising expenses will become a cause of worry for you. Try to stay away from relatives. To get peace of mind, pray the Moti Haptan Yasht daily.



Virgo - કન્યા - પ.ઠ.ણ.

૨૪મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારું સાચું બોલવાનું કોઈકને કડવા ઝેર જેવું લાગશે. તમે સ્વભાવથી ખૂબ જ સેન્સીટીવ હોવાથી બીજાને મદદ કરવા જતા તમે નુકશાનીના ખાડામાં ઉતરી જશો. મંગળને કારણે પ્રેશર ઉપર-નીચે થયા કરશે. માંદગીનું નિવારણ કરવા માંગતા હો તો રોજ 'તીર યજ્ઞ' ભણજો. શુકનવંતી તા. ૫, ૬, ૮, ૧૦ છે.

Lucky Dates: 5, 6, 9, 10.

Mars' rule till 24th December might make your words seem like poison to other. Trying to help another will surely land you in losses. Mars could affect your Blood Pressure levels. To alleviate any illnesses from your home and placate Mars, pray the Tir Yasht daily.



Sagittarius - ધન - ભ.ધ.ફ.

૧૬મી ડિસેમ્બર સુધી શુકની દિનદશા ચાલશે તેથી હાલમાં ઘણી-ઘણીયાણીના કામો પહેલા પૂરા કરી લેજો. શુકની કૃપા તમારા મનની વાત બીજાને કરીને મન ઉપરનો બોજો ઓછો કરી નાખજો. નાણાકીય સ્થિતિ સારી હોય તો બીજાના મદદગાર જરૂર થઈ જશે. રોજબરોજના કામો વિજળી વેગે પૂરા કરવામાં સફળ થશો. હાલમાં દરરોજ 'બહેરામ યજ્ઞ'ની આરાધના કરજો. શુકનવંતી તા. ૪, ૭, ૮, ૯.

Lucky Dates: 4, 7, 8, 9.

Venus' rule till 16th December suggests that you prioritize the completion of work related to your spouse. Speaking about what's on your mind with another will reduce your mental tension. If you are in a good place financially, you are encouraged to help others. You will be successful in completing your daily tasks at lightning speed. Pray to Behram Yazad daily.



Pisces - મીન - દ.ચ.ઝ.થ.શ.

૫મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ ઉડી જશે. ખર્ચનો ખાડો ઊંડો થતો જશે. તમારા પોતાના અંગત વ્યક્તિ તમારી સાથે દુસ્મન જેવો વહેવાર કરશે તેનું દુ:ખ લાગશે. જ્યાંબી કામ કરતા હો ત્યાં કોઈબી વ્યક્તિ સાથે ખોટી બોલાચાલી નહીં કરતા. હાલમાં દરરોજ 'મહાબોખ્તાર નીઆયેશ' ભણજો. શુકનવંતી તા. ૧૭ થી ૨૦ છે.

Lucky Dates: 17 to 20.

Rahu's rule till 5th January will rob you off your sleep and appetite. Expenses will increase greatly. Those close to you will treat you like a stranger, and this will hurt you. Avoid getting into any kind of unnecessary arguments with your colleagues at the workplace. Pray the Mah Bokhtar Nyaish daily.



DARA M. KHODAIJI

Come December

ensconced in fox-fur draped over her shoulder, at a wedding at the Colaba Agiary compound.

Just like, when asked by a reporter why he climbed the Everest, Sir Edmund Hillary had replied, "It is there." She too, must have worn the fox fur for the same reason - it was there! The fifties were an age of elegant dressing. The informal sloppiness of the present day's jeans and t-shirts with an equally sloppy jacket

dudhwala, without having to worry about going to work the next morn! Those were the days when New Year's Day used to be a bank holiday. It was so until one of those sadistic blokes, who infest the corridors of power, thought it would be fun to see people trudging to office after waltzing, fox trotting or jiving till the wee hours of the morn and then attend office on the first day of January with tired feet, and head heavy from a monumental hangover!



of garlic - *lilu lasun nu eedu*. Fortunately, *vasanu* is still Parsis' favourite winter energizer. At dinnertime, we would have the luscious vegetable 'papri' (flat-beans) - Papri-ma-kabab or Papri-ma-ghosh that comes with medley of other veggies like baby potatoes, small whole onions and aubergines. Cloves of garlic, sweet potatoes and the purple-coloured, *kamorio kand* in Gujarati and a lot more. Fortunately, we still have the above delicacies.

around. One is Mahimkar and the other is the Marine Liner and the twain rarely meet because each area is self-sufficient today. Whether you want vegetables or Versace, jewelry or junk food - your area has it. Good schools and colleges too. It is only later in life that one will have to venture out to a far off work-place.

*Come December, 'tis the most beautiful month of the year, Come December, Christmas time is here!
Come December, 'tis time for peace and goodwill everywhere,
Come December, 'tis festive, fun time, food and good times to share!*

Unlike today, about half a century ago, as students, we would receive long winter vacation time of about 15 days. As a schoolboy, I remember visiting the USIS Library, about a stone's throw away from where it stands today. There was a children's room with books suitable for kids. We read of the boy George Washington chopping down his father's favorite cherry tree, and about Lincoln's log cabin, his rise to the US presidency and later, his assassination; we read of Injuns and cowboys, of the Generals Lee and Grant, of Benjamin Franklyn flying a kite during a thunderstorm... fascinated, we read about sky scrapers in New York and about the grand canyon and the Niagara Falls.

One also read about the various states the USA, about the beautiful North American states where, come December, the landscape turned to a snowy winter wonderland. Mumbai or Bombay, as it was then called, did not enjoy the phenomenon of such weather. Mild winters only, here! No snow! I had to wait years before I experienced it in Europe. Still, come December, Bombay became cooler, sometimes even colder, and out came the Bombay's winter-wear, light cardigans, pullovers, jackets and other woolies. Once I even saw a lady sporting a mink coat near the Taj and another time, a lady



Come December and hawkers would display beautiful Christmas / New Year cards. Yes, we used to greet our dear ones with cards, some funny, some teary, some with somber message or good advice and some with nonsense verse. One

or a blazer that pass off as formal wear, was a strict no-no. Even though the footwear might have been an expensive brand name in sportswear, it was shunned, except on the sports ground. Neck-ties were in as were bow-ties. My papa

looked forward to receiving them too. No e-greeting can replace a good greeting card. I still look forward to receiving them. None come or rarely come. Sending greetings was a ritual too that began almost a month before the occasion.



owned a number of 'Tootal ties' that I started using once I was tall enough. I remember having an aversion against the pre-knotted ties, bow or any other neckwear.

At eighteen, for the first time did I wear a tux to for the New Year's Eve Ball. I nearly ruined two black bows-ties, trying to knot them into a perfect butterfly, but to no avail. I took a good forty-five minutes of tying, untying and ironing and re-ironing the damned thing till I was satisfied! My family looked on with amusement at my frustrating inability to get it right. I still can't! I am all thumbs. But then, I was no David Niven or Rex Harrison then, and most certainly no Fred Astair too, but I could dance away till the wee hours of the morning, assaulting the feet of my partners with my number nine shoes! We would return home later than the

Come December, it is time for '*vasanu*' - a must have winter concoction, rich with kilos of pure ghee and ginger powder, dry fruits, nuts, and about hundred other ingredients with jaw-breaking names! It takes hours of hard work to make it, but it is worth every penny, every second, every effort creating this masterpiece. It would be a festive time when *vasanu* was prepared by my mom and several of her friends, all at our place, descending en masse with their lovely daughters. O, for those pleasant days! The ladies in the kitchen stirring away the ingredients à la witches in Macbeth chanting, "Double, double, toil and trouble; Fire burn and caldron bubble"... but, the ladies were not evil witches and the caldron was bubbling away with *vasanu* and not snaps and snails and puppy-dog tails. High tea was served with *bhakhras*, cupcakes, patties, and mutton-mince samosas.

Come December and the breakfast table often had scrambled eggs with greens



Early mornings used to be crowned with tall glasses of Dudh-na puffs. Puffs, like the head or foam on beer are very light and is made by chilling the milk overnight and then churning it by hand churner or by blender. The foamy, feathery light product is scooped up in a glass. It was a great treat that has been missed out by a couple of our younger generations. A pity!

Come December and it's Christmas time. There would be a rush at Colaba, Crawford Market (now renamed Jyotiba Phule Market but still referred to mostly by the old name) and Grant Road. These were the shopping areas. Today, every area has its shopping areas or malls, be it Bandra or Borivili or Bhandup. This is the reason why children are very local today. A boy from Mahim will hardly be acquainted with Marine Lines and the other way

be seen smoking cigars, a habit totally absent today.

Come December and it is New Year's Eve! Eat, drink, party all night and be ready to greet the New Year the next day. Just as I write with nostalgia

about the good old fifties, I realise my granddaughter might one day pay a nostalgic tribute to the good ol' days of 2020s! The world goes on...

Till then, here's wishing we all have a Merry Christmas and a Very Happy and Healthy New Year 2022!!



Dr. Jasvi's Numero Tarot Predictions

(As Per Your Birth Month)



Parsi Times brings you Dr. Jasvi's column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth:

January (Lucky No. 10; Lucky Card: Wheel Of Fortune): You need to take the world in your stride. Travel abroad is indicated. This month assures you of financial stability. Remember that any change happening now is for your betterment, so accept it instead of fighting it. Overall, this will be a romantic month for people born in January.

February (Lucky No. 19; Lucky Card: Sun): You are blessed by the Divine Mother this month. Thank the universe for your countless blessings. This month brings you name, fame and prosperity. Emotional support will be available for you. Sound sleep is a must for you. You are advised to rise above your confrontational situations. Postpone the idea of buying or renovating property for a few months.

March (Lucky No. 11; Lucky Card: Justice): Justice is your card for the month indicating that your legal matters will get sorted out. You are advised to wear Pearl to overcome your confusions and mood swings. You could undergo a temporary phase of non-liquidity of cash. But, you will be able to balance your income and expenses. You might or might not be able to save up this month.

April (Lucky No. 8; Lucky Card: Strength): Confidence is the key to success. You might need to fight for your rights. Learn to be practical but also heed and follow your intuition. You need to reflect a little as you search the right path to reach your destination. Do not rush into any decisions or action, without thoroughly thinking things through.

May (Lucky No. 1; Lucky Card: The Magician): You need to clear your thoughts and realize that all that glitters is not gold. Come out of your illusions. Learn to be more practical. Financial support will be available when needed. You will be divinely protected in all areas of life.

June (Lucky No. 17; Lucky Card: Star): This is the perfect time to start new partnerships. Your health will be in great shape. However, try to clear your mental confusions. Keep in mind that every end heralds a new beginning. Start afresh. Be sure to avail of expert advice, if needed. You are blessed abundantly. Move on with pride.

July (Lucky No. 6; Lucky Card: Lovers): Your spiritual healing has started. Any health issues will start moving towards recovery and progress. Success and victory are on the cards for you. You are intelligent enough to make your own decisions, so do not put aside your thoughts for others. Try to sort out any confusions you are dealing with.

August (Lucky No. 21; Lucky Card: World): Remember - as you sow, so shall you reap. This is the time to pay your karmic debts. A little charity is advised. A small journey will be possible in this month. An automatic balance will resume divinely itself in your situation.

September (Lucky No. 4; Lucky Card: Emperor): Your health will be at its best. This is a phase of emotional stability for you. You are advised to beware of back-stabbers. This is an ideal month especially for ladies born in September. Enjoy yourself and smile - happy times are here again!

October (Lucky No. 3; Lucky Card: Empress): Sudden short travel is indicated. This is the time for you to implement your ideas. Do not give in to feelings of being neglected. You need to stop complaining about the little things you don't have and appreciate all that you do. Keep in mind that happiness is art of making a bouquet of the flowers at hand, it is within your reach.

November (Lucky No. 2; Lucky Card: High Priestess): This is simply a wonderful time for students born in November. Don't overstress yourself or you could end up harming your own health. You are advised to be careful before jumping into things. There is a new beginning in store for you. Start with full enthusiasm and zest. And don't forget to celebrate!

December (Lucky No. 5; Lucky Card: Hierophant): Enjoy the splendid rainbow of happiness, love, peace and satisfaction with your loved ones. There could be a little extra work for a few days for you, in this month. Your health will be in top condition. You are advised to bathe with rock salt to ward off any negative energy.



Reader's Corner

Parsi Times is delighted to present the writings of our talented readers with the Community, via our promotional platform - Reader's Corner. We encourage and promote our budding writers, to share your original works - poetry or prose, by offering the opportunity of getting your work published in Parsi Times - the Community's leading Newspaper! Mail us with your contributions at editor@parsi-times.com

At The Beach

By Meher P Sutaria

I go to the beach where the sea is blue,
And the sky is peach of a gorgeous hue;
The golden sun is going down to rest,
All I can see is its curving crest.


The waves come crashing to the shore,
I now can see the sun no more!
The whooshing winds, the gusts of air,
Play joyfully with my tousled hair.

I go forward with a frisky stride,
Happily, I cast my shoes aside;
The cool waves splash about my toes,
And sweep the sands along the shores.

The seagulls begin their plaintive cry,
Now it's time to say goodbye.
Twilight has brought the curtains down,
Once more, I turn and look around.

I still hear the sound of the churning surf,
As I make my way along the turf;
I look at the heavens - they've now turned dark,
I see them pinned with a thousand stars.

I love my visits to the sea,
They bring back childhood memories to me...
When my siblings and I would play with glee,
On the spotlessly clean beach of Zahi-Bordi.



Our Beloved Prophet Zarathustra

By Gulshan D. Morawala

When we could barely walk or speak,
We were taught Your blessings to seek,
Morning, noon and night - we were told,
To bow before You and Your hand, to hold.
You are our Prophet most kind,
You grant wishes we desire in our mind,
You taught Good Thoughts, Good Words and Deeds,
To reach God - this is what we would need.
When I stand before Your photo frame,
My Zarathustra, I chant Your revered name,
With deep love for You within my heart,
And vow from You, I will never part.
I am but a simple mortal soul,
I seek Your guidance to reach my goals,
Share Your strength with me, I plead,
For to reach Mazda, that's what I need.
Pray, shower Your blessings on young and old,
Keep all Zoroastrians within your fold,
For I wish this mighty religion of ours,
Just grows stronger by the hour.
On my part, however tiny I be,
I join my hands and go down on my knees,
I cry out to Ahura Mazda to thank Him so,
For sending us a Prophet who saved us from woe.
May Your divine spirit live on and on,
Let our connection turn into a strong bond,
I sincerely wish, that one day,
I see Your blessed face, Zarathustra, if I may?
My heart just throbs as I seek this wish,
I'm sure You will not think it amiss,
But I live from morn to night each day,
Hoping my luck will shine away

EXCLUSIVELY FOR PARSI TIMES READERS!!

**Book Your Personal Numero-Tarot Readings
by Dr. Jasvi herself! Get a 30-minutes
Session worth Rs. 2,499/- for ONLY at Rs. 499/-!!**



RUBY LILAOWALA

The Rhythm Of Life

I could till I was 75, but I still manage one step at a time, imagining that I'm going up two steps at a time.

Your mind is always where the limitations start and finish. Reawaken and refurbish your mind with the youthful spirit. What are you afraid of? Are you afraid to die or are you afraid to live? When you walk, or jog, or run or dance, your energy becomes more fluid and consequently, your chakras become aligned - that is what I learnt in Yoga!

You can walk, jog, run or dance to songs, chants, rhythm or rhymes. Find a way to move your body daily. Trust your body. Say, "I will, and I can". Take the first step because as the philosopher said, "the journey of a thousand miles begins with the first step."

Each and every spiritual tradition includes the practice of "paying attention", focusing, being in the moment. Pay attention to your movement. The older you grow the more you should move. Look for opportunities to move. Don't worry about your "foot-speed". Walk as slowly as you can at first. Be consistent and over time, you'll get a good foot-speed. You are not in a race. You are not walking to prove anything to anybody. You are slower than the others. So what? Your body knows exactly at what pace you should walk, so honour your individual pace and your inner body-rhythm.

In music, we learn that a grace-note is an extra-note, a tiny little note. In life, grace-notes are the little things that make us happy and cost nothing. Movement is one of them and it's so important to live a good "quality" of life. And life is so fragile, so temporary. Why not move and dance till we are alive?

Rhythm is inherent in nature and therefore in humans. The beat of our body is the beat of the Earth. The cycles of day and night, the moon and the seasons are all reflected in the body. Which is the best time for movement? As soon as you get up. Your body has already rested for eight hours and your mind is fresh. This is the best time to go and walk which is why we call it a 'morning-walk'. However, don't just walk mechanically. Observe everything around you in silence. Trees, grass, flowers, clouds and the road (or else you'll trip and fall) and other morning walkers. Listen to sounds as you walk. The chirping of birds, the rustle of leaves and the cycle-ring of the milk-

man or the bread-wala. Breathe in the positivity of the fresh morning air. Breathe deeply, to energise your lungs. Do this just for a few days and chances are you will not only get hooked to it but also start enjoying it, so much that you'll never miss out on your morning-walks. In fact, you'll look forward to them as you wake up each morning with a prayer on your lips and a wow in your mind!! You'll feel so good about yourself because you are doing something positive for your health.

What about a person in a wheelchair?

Well, move your neck, hands and arms to do simple exercises. If your feet can't do the movement, nod your head, roll your neck, wink your eye and listen to the dancing beat of your heart. Trust your body. Move to your own rhythm but move, because movement is life. Behavior is based on beliefs. Action doesn't begin in muscles, it begins in your mind. Movement will help you recognise and reacquaint yourself with the magic of your childhood and to capture the power of movement - of dancing through life!! And your time begins NOW!

Most of us don't move enough. In fact, we don't walk much or even fully breathe. The human body is made for movement, which is life. When movement stops completely, we call it death. Movement starts with the very first experimental kicks of the foetus within the mother's body. It registers as a tickle and the expectant parents are thrilled, saying, "the baby kicked." It also registers in sonography and the parents are happy that everything is normal.

No matter what your age, no matter what your station in life, no matter what the current state of your health, make 'movement' your priority. It isn't about 'just do it', as the Nike advert says. At any stage in life, we must do it. It doesn't have to be planned and it doesn't have to be perfect, but the dance of life has to be performed.

There's movement all around us - kids on a merry-go-round, rain lapping on the ground, a butterfly's erratic flight, the sun fading into night... There's also constant movement within us - the beating of the heart, the circulating blood, the throbbing pulse, etc.

If you've been inactive so far, never mind. It's never too late. The time to start moving is now and the place is here! Take baby-steps. Take your time. Do everything at your pace. Life is not a race. Take it slow. But do hear the music before the song is over! Several senior citizens complain that their knees and backs hurt, so they just take it easy all day, either on the sofa or on the bed. They hardly leave the house. This is wrong because today they are house-bound but tomorrow, their muscles will atrophy and they will be bed-ridden. Old people should be motivated, "Get out of that sofa, get out of the house and walk." If you are too sick to go out and climb stairs, walk around the house - start with two minutes every hour and then increase it to five, then ten, fifteen and soon you'll manage half an hour. Just get out of your mental block and try it.

I stay on the third floor and am so grateful to God that there's no lift because unlike my friends who go to fancy gyms to do step-climbing, I get to do it for free twice and sometimes thrice a day. While climbing, I find it difficult to take two steps at a time as

Suresh Shah
 98202 62098
 98202 11374
 2342 7677
 2344 7677

Om dryfruits
 Dry Fruits & Kirana Merchants

કેલેફોર્નિયા બદામ	૭૨૦	જમ્બો એપ્રીકોટ (જરદાળુ)	૧૪૦૦	હેડલ નટ /રોઝી બેરી	૧૨૦૦
કેલેફોર્નિયા M બદામ	૭૬૦	A અંજીર	૧૨૦૦	મુન્સ	૬૮૦
કેલેફોર્નિયા A બદામ	૮૦૦	2A અંજીર	૧૪૦૦	મોક્ષ ડ્રાયફ્રુટ	૮૦૦/૧૦૦૦
કેલેફોર્નિયા 2A બદામ	૯૦૦	3A અંજીર	૧૬૦૦	રજવાડી મોક્ષ ડ્રાયફ્રુટ	૧૪૦૦
કેલેફોર્નિયા 3A બદામ	૧૦૦૦	4A અંજીર	૧૮૦૦	પીકન નટ	૨૦૦૦
સોલ્ટેડ બદામ	૮૦૦	જમ્બો અંજીર	૨૨૦૦	મેકેડોમીયા નટસ	૩૪૦૦
સોલ્ટેડ 3A બદામ	૧૦૦૦	પીસ્તા મગજ	૧૫૦૦	ચીલગોઝા	૫૬૦૦
બેસ્ટ ટોચ મમરા બદામ	૧૬૦૦	મોટા પીસ્તા મગજ	૧૮૦૦	મખાના રેન્યુલર	૯૦૦
2A મામરા બદામ	૨૪૦૦	જમ્બો પીસ્તા મગજ	૨૦૦૦	2A મખાના	૧૦૦૦
3A મામરા બદામ	૨૬૦૦	પિશોરી પીસ્તા	૨૪૦૦	જમ્બો મખાના	૧૧૦૦
4A મામરા બદામ	૩૬૦૦	પીસ્તા સ્લાઈસ	૧૮૦૦	ફલેવર્ડ મખાના (૧૦૦ ગ્રામ)	૧૨૦
5A મામરા બદામ	૪૫૦૦	સોલ્ટેડ પીસ્તા	૧૦૦૦	ટર્કીશ એપ્રીકોટ (આલુચા)	૬૮૦
6A જમ્બો મામરા બદામ	૫૫૦૦	2A સોલ્ટેડ પીસ્તા	૧૨૦૦	ગુંદ (ડીક)	૨૦૦
બદામ સ્લાઈસ	૮૦૦	3A સોલ્ટેડ પીસ્તા	૧૬૦૦	સૂકી ખજૂર (ખારેક)	૪૦૦
રેન્યુલર કાજુ	૯૦૦	અકબરી સોલ્ટેડ પીસ્તા	૧૮૦૦	ખારેક પાવડર	૪૦૦
1A કાજુ	૧૦૦૦	પબડી ગોટા	૮૦૦	ડ્રાયફ્રુટ ચિક્કી	૪૮૦
2A કાજુ	૧૨૦૦	કીમીયા કાળી ખજૂર	૧૬૦૦	સ્પે. ડ્રાયફ્રુટચિક્કી ગુલાબ પત્તી	૬૮૦
3A કાજુ	૧૩૦૦	ઓમાન કાળી ખજૂર	૩૨૦	જીરાગોળી	૨૦૦
4A જમ્બો કાજુ	૧૬૦૦	ઓમાન કાળી ખજૂર સીડલેસ	૩૬૦	મોઠા આમળા	૨૪૦
રોસ્ટેડ કાજુ (સોલ્ટેડ)	૧૦૦૦	કલમી ખજૂર	૬૦૦	હની આખા આમળા	૩૬૦
2A સોલ્ટેડ કાજુ	૧૨૦૦	કલમી ખજૂર સીડલેસ	૭૫૦	આમળા / બેલ મુરબ્બા	૧૬૦
રોસ્ટેડ કાજુ જમ્બો	૧૫૦૦	મજદૂલ ખજૂર (લૂજ)	૧૧૦૦	કાકીરજની મિશ્રી	૮૦
મસાલા કાજુ	૧૨૦૦	મજદૂલ ખજૂર	૧૪૦૦	વાળા મિશ્રી	૧૬૦
મરી કાજુ	૧૨૦૦	અજવા ખજૂર	૧૪૦૦	ઈરાની કેસર (૧ ગ્રામ)	૨૦૦
કાજુ કણી સફેદ	૪૦૦	લાલ ખજૂર	૧૦૦	કાશ્મીર કેસર (૧ ગ્રામ)	૨૫૦
કાજુ ટુકડા રેન્યુલર	૭૨૦	સીડલેસ લાલ ખજૂર	૧૬૦	સ્પેનીશ કેસર (૧ ગ્રામ)	૪૦૦
કાજુ ટુકડા મોટી સ્લાઈઝ	૮૦૦	પમ્પકીન સીડસ	૬૦૦	સ્પેનીશ કેસર (૨૮ ગ્રામ)	૫૫૦૦
કાજુ ટુકડા કાંચા	૯૦૦	રોસ્ટેડ પમ્પકીન સીડસ	૭૦૦	કપુર	૧૨૦૦
જમ્બો કાજુ ફાંચા	૧૦૦૦	સનફલાવર સીડ	૪૦૦	ભીંમસેની કપુર	૧૬૦૦
કાજુ પુરી	૮૦૦	રોસ્ટેડ સનફલાવર સીડ	૫૦૦	---વસાણા ની સામગ્રી---	
ઈન્ડિયન કિસમિસ	૩૬૦	ચીયા સીડસ	૪૦૦	ગોખર (પાવડર)	૩૬૦
ઈન્ડિયન કિસમિસ લાંબી	૪૮૦	ક્યુનોવા	૩૬૦	સફેદ મુસલી (પાવડર)	૧૬૦૦
અફઘાની કિસમિસ	૭૦૦	કલીંગડ સીડસ	૨૮૦	કાળી મુસલી (પાવડર)	૬૦૦
અફઘાની ગ્રીન કિસમિસ	૧૦૦૦	ફલેક્સ સીડસ (અળસી)	૧૨૦	અકેલખેડા	૧૨૦૦
સિન્થુકાની ગ્રીન કિસમિસ	૧૬૦૦	રોસ્ટેડ ફલેક્સ સીડસ (અળસી)	૧૬૦	હીન્ડીપીપર	૮૦૦
સીડલેસ કાળી કિસમિસ	૪૦૦	રોસ્ટેડ ૭ સીડસ	૬૦૦	સતાવર (પાવડર)	૪૮૦
રેન્યુલર કાળી કિસમિસ	૪૮૦	ધાણાદાળ	૨૮૦	લોજર	૩૦૦
મોટી સીડલેસ કાળી કિસમિસ	૬૫૦	ઓર્ગેનિક સુંઠ પાઉડર	૫૦૦	બારબી	૪૦૦
મોટી કાળી કિસમિસ	૭૬૦	સ્વીટ ડ્રાયફ્રુટ ભેળ	૧૦૦૦	ચોપચીની	૧૦૦૦
જંબો સીડલેસ કાળી કિસમિસ	૧૦૦૦	સ્પાઈસી ડ્રાયફ્રુટ ભેળ	૧૦૦૦	સાલેમપંજો	૧૬૦૦૦
આખા અખરોટ	૯૦૦	બેસ્ટ ચા મસાલા	૮૦૦	આખરો	૮૦૦
અખરોટ કણી	૮૦૦	બેસ્ટ ગરમ મસાલા	૮૦૦	કોચાબીજ	૨૮૦
અખરોટ ક્વાર્ટર ટુકડા	૧૩૦૦	બેસ્ટ કેસરી દૂધ મસાલા	૨૪૦૦	અશ્વગંધા	૬૮૦
અખરોટ મગજ રેન્યુલર	૧૫૦૦	ચારોલી	૧૪૦૦	ખસખસ	૨૨૦૦
કેલેફોર્નિયા અખરોટ મગજ	૧૬૦૦	ગ્રીન ઈલાયચી ૨૦૦૦/૨૪૦૦/૨૮૦૦	૩૨૦૦	સુંઠ	૪૮૦
હાઈઈટ અખરોટ	૧૮૦૦	સુપરગ્રીન ઈલાયચી	૩૨૦૦	પૌપરામુળ	૧૨૦૦
જમ્બો સુપર હાઈઈટ અખરોટ	૨૦૦૦	ઈલાયચી પાવડર	૩૦૦૦	સફેદ મરી	૧૦૦૦
એપ્રીકોટ (જરદાળુ) રેન્યુલર	૮૦૦	કેનબેરી	૬૮૦	સીંગોડા	૪૦૦
2A એપ્રીકોટ (જરદાળુ)	૧૦૦૦	બ્લુ બેરી	૧૬૦૦	ચારમગજ	૮૦૦
3A એપ્રીકોટ (જરદાળુ)	૧૨૦૦	બ્રાઝિલ નટસ	૨૪૦૦	શી નુદુધ	૧૬૦
				કમલી મગજ	૮૦૦

FREE HOME DELIVERY અમારો હેતુ: તમારી સુરક્ષા, અમારી સેવા. પેમેન્ટ: કેશ આન ડિલિવરી બેંક ટ્રાન્સફર, જીપે, પેટીએમ અને ક્રેડિટ કાર્ડ

કોરોનાકાળમાં વેરબેઠાં ઓર્ડર કરો

ઉ. જેબી શાહ માર્કેટ, પ્રભુ હોટલ સામે, સ્ટેશન નજીક, મસ્જિદ બંદર (પ.), મુંબઈ-૯. Call: 23427677 / 23447677

દરેક પ્રકારના પાઘ ધી-તેલ હોલસેલ ભાવથી ઉપલબ્ધ. બધી જ ગ્રાન્ટ્સ હવે હોલસેલ ભાવે ઉપલબ્ધ

શ્રેષ્ઠ ગુણવત્તાના સૂકા મેવા, ગ્રોસરી, મસાલા અને ધી માટેની ફી હોમ ડિલિવરી માટે ઓમ ડ્રાયફ્રુટ્સનો સંપર્ક કરો

Rates per kg. Min. bill amt Rs. 2,000/-